To

Bombay Stock Exchange Limited	National Stock Exchange of India		
Department of Corporate Services,	Limited		
SP. J. Towers, Dalal Street,	ListingCompliance Department		
Mumbai – 400 001	Exchange Plaza, Bandra-Kurla Complex,		
(Scrip Code-514162)	Bandra (E), Mumbai – 400 051		
,	(Symbol: WELSPUNIND)		

Dear Sirs/ Madam,

Sub: Disclosure under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Further to our letter dated August 31, 2023, with regard to dispatch of the Annual Report for the financial 2022-23 alongwith the Notice of the 38th Annual General Meeting ("Annual Report and Notice"), please find enclosed herewith the copies of the advertisements published in the English Language – 'Financial Express' and Gujarati translation thereof in 'Kutch Mitra' and 'Kutch Uday' on September 02, 2023 with respect to holding of 38th Annual General Meeting of the Company on Friday, September 22, 2023 at 11.00 a.m through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") and completion of dispatch of Annual Report and Notice to the shareholders including details regarding e-voting facility as per Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record.

For Welspun India Limited

Shashikant Thorat Company Secretary ICSI Membership No.: FCS-6505

Encl: as above

Welspun India Limited

Welspun House, 6th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai 400 013, India. T: +91 22 6613 6000 / 2490 8000 F: +91 22 2490 8020 / 2490 8021

E-mail: companysecretary_wil@welspun.com Website: www.welspunindia.com

Registered Address: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat 370 110, India. T:+91 2836 661 111 F:+91 2836 279 010

Works: Survey No. 76, Village Morai, Vapi, District Valsad, Gujarat 396 191, India. T: +91 260 2437437 F: +91 260 22437088

1. 31200 243/43/ 1. 31200 2243/000

FINANCIAL EXPRESS



SG FINSERVE LIMITED

Corporate Identity Number: L64990DL1994PLC057941 Tel.: 91-11-22373437

Regd. Office: 37, Hargobind Enclave, Vikas Marg, Delhi-110092

Website: www.sgfinserve.com, Email: compliance@sgfinserve.com

NOTICE TO THE MEMBERS FOR THE 29™ ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that 29" AGM of the Company will be held on Tuesday, September 26, 2023 at 11.00 A.M. through VC facility, as per the provisions of the Companies Act, 2013 ("Act") and Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ["SEBI (LODR) Regulations"] read with Ministry of Corporate Affairs ("MCA") Circular No. 20/2020 dated May 5, 2020 and Circular No. 14/2020 17/2020, 02/2021, 02/2022 dated April 8, 2020, April 13, 2020, January 13, 2021 and May 5 2022 respectively and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12 2020. Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars"), without the physical presence of the Members at

In compliance with the relevant SEBI and MCA Circulars, the Notice of the 29" AGM and Annual Report of the Company for the Financial Year that ended on March 31, 2023, along with login details for joining the 29" AGM through VC facility including e-voting will be sent only by e-mail to all those Members, whose e-mail addresses are already registered with the Company or the Registrar and Share Transfer Agent or with their respective Depository Participants ("DP"). Please note that the requirement of sending physical copy of the Notice of the 29th AGM and Annual Report to the Members have been dispensed with vide MCA Circular(s) and SEBI Circular(s).

Members can join and participate in the 29" AGM through VC facility only. The instructions for joining the AGM are provided in the Notice. Members participating through VC facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Notice of the 29" AGM and the Annual Report will also be made available on Company's website (www.sgfinserve.com), Stock Exchange' websites (www.bseindia.com) and on the website of Central Depository Services (India) Limited ("CDSL") (www.evotingindia.com).

The Company is providing remote e-voting (prior to AGM) and e-voting (during the AGM facility to all its Members to cast their votes on all the resolutions set out in the Notice of the 29 AGM. Detailed instructions for remote e-voting are provided in the said Notice. The facility of casting the votes by the members ("e-voting") will be provided by CDSL. The remote e-voting period commences on September 23, 2023 (10:00 A.M.) and ends on September 25, 2023 (05:00 P.M.). During this period, members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of Tuesday, September 19, 2023, may cast their vote by remote e-voting or by e-voting at the time of AGM. Members participating through VC / OAVM shall be counted for reckoning the quorum under section 103 of the Act.

Members who have not registered their e-mail address with the Company or RTA, can registe their e-mail address for receipt of Notice of 29th AGM, Annual Report and login details for joining the 29" AGM through VC facility including e-voting by sending a request to M/s Skyline Financial Services Private Limited, Registrar and Share Transfer Agent at compliances@skylinerta.com or to the Company at compliance@sgfinserve.com, by providing their name, folio number/DPID & Client ID, client master or copy of consolidated account statement (in the case of demat holding), copy of share certificate - front and back (in the case of physical holdings), self- attested scanned copy of the PAN card and self-attested scanned copy of Aadhar Card in support for registering e-mail address.

In case of demat holding, please contact your DP and register email address and bank account details in your demat account, as per the process advised by your Depository Participant.

Any person who acquires shares and becomes Member of the Company after the date of electronic dispatch of Notice of 29" AGM and holding shares as on the cut-off date i.e. Tuesday, September 19, 2023, may obtain the Login ID and Password by following the instructions as mentioned in the Notice of 29" AGM or sending a request at helpdesk.evoting@cdslindia.com

If you have any gueries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call toll free no. 1800225533.

The Notice of AGM and Annual Report for financial year 2022-23 will be sent to members in accordance with the applicable laws on their registered email addresses in due course.

> For and on behalf of SG Finserve Limited Ritu Nagpal Company Secretary M.No.: A38318

Date: September 02, 2023 Place: Delhi

6 Piramal

PIRAMAL ENTERPRISES LIMITED

Registered Office: Piramal Ananta, Agastya Corporate Park, Opposite Fire Brigade, Kamani Junction, LBS Marg, Kurla (West), Mumbai 400070; Tel. No.: +91 22 3802 3000/4000 Fax No.: +91 22 3802 3884; E-mail: complianceofficer.pel@piramal.com Website: www.piramal.com; Company Secretary: Mr. Bipin Singh

Corporate Identity Number ("CIN"): L24110MH1947PLC005719

EQUITY SHARES ("SECOND CORRIGENDA") This Second Corrigenda is in continuation of and should be read in conjunction with the Letter of Offer dated August 27, 2023 ("Letter of Offer"), advertisement dated August 28, 2023 (the

SECOND CORRIGENDA AND NOTICE TO ELIGIBLE SHAREHOLDERS - BUYBACK OF

"Advertisement") and Corrigenda and Notice to Eligible Shareholders dated August 29, 2023 (the "Corrigenda") in connection with the Buyback as the context may require. In the Letter of Offer, the Company had informed Eligible Shareholders that the members of the Promoter and Promoter Group had expressed their intention to not participate in the Buyback

offer. Accordingly, in paragraph 19.9.1.1 of the Letter of Offer, the Company had disclosed that the Buyback Entitlement of the Promoter and Promoter Group will be available for Eligible Shareholders who validly tender Additional Equity Shares over and above their respective In order to bring greater clarity to Eligible Shareholders who wish to participate in the Buyback the Buyback Entitlement for General Category for all other Eligible Shareholders after excluding

the Promoter and Promoter Group Entitlement has increased from 1 (one) equity share out of every 19 (nineteen) fully paid-up equity shares held on the Record Date to 7 (Seven) equity shares out of every 71 (Seventy One) fully paid-up equity shares held on the Record Date. The Buyback Entitlement for Small Shareholders continues to be 7 (Seven) equity shares out

of every 47 (Forty Seven) fully paid-up equity shares held on the Record Date The actual Buyback Entitlement factor for General Category for all other Eligible Shareholders

(excluding the Promoter and Promoter Group) is 9.852752110048% and Reserved category for

Small Shareholders is 14.888791363367%. Eligible Shareholders who have tendered their Equity Shares may note that modification/ cancellation and multiple bids are allowed during the Tendering Period.

Please refer to Clause 20 (PROCEDURE FOR TENDER OFFER AND SETTLEMENT) of the Letter of Offer for details of participation in the Buyback. Eligible Shareholders are requested to note the following changes/amendments to the Letter of

Offer, the Corrigenda and the Advertisement.

1. The Buyback Entitlement on the Cover Page of the Letter of Offer and in the Advertisement shall be replaced with:

BUYBACK	ENTITLEMENT
CATEGORY OF ELIGIBLE SHAREHOLDERS	Ratio of Buyback (i.e., Buyback Entitlement) *
RESERVED CATEGORY FOR SMALL SHAREHOLDERS	7 (Seven) Equity Shares out of every 47 (Forty Seven) fully paid-up Equity Shares held on the Record Date.
GENERAL CATEGORY FOR ALL OTHER ELIGIBLE SHAREHOLDERS (EXCLUDING THE PROMOTER AND PROMOTER GROUP)	7 (Seven) Equity Shares out of every 71 (Seventy One) fully paid-up Equity Shares held on the Record Date.

Category, please refer to paragraph 19.5.6 on page 57 of the Letter of Offer.

*19.5.5. In compliance with Regulation 6 of the Buyback Regulations, the reservation for the

Small Shareholders, will be the higher of:

21,00,000 (Twenty One Lakhs only) Equity Shares; or 19.5.5.2 The number of Equity Shares entitled as per their shareholding as on the Record

Date fi.e. (1,41,04,570/ 13,48,83,007) x 1,40,00,000] which is 14,63,965 (Fourteen Lakhs Sixty Three Thousand Nine Hundred and Sixty Five) Equity Shares. 19.5.5.2.1 All the outstanding fully paid-up Equity Shares excluding shares held by Promoter

and Promoter Group have been used for computing the Buyback Entitlement of Small 19.5.5.2.2 Based on the above and in accordance with Regulation 6 of the Buyback

Regulations, 21,00,000 (Twenty One Lakhs) fully paid-up Equity Shares have been reserved for Small Shareholders. Accordingly, General Category for all other Eligible Shareholders (excluding the Promoter and Promoter Group) shall consist of 1,19,00,000 (One Crore Nineteen Lakhs) Equity Shares.

Please note there is no change in the reservation of the small shareholders, despite the exclusion of the shares held by the Promoter and Promoter Group in computing the Buyback Entitlement of Small Shareholders.

*19.5.6 Based on the above Buyback Entitlements, the ratio of Buyback for both categories is

Category of Shareholders	Ratio of Buyback*
Reserved category for Small Shareholders	7 (Seven) Equity Shares out of every 47 (Forty Seven) fully paid-up Equity Shares held on the Record Date.
General Category for all other Eligible Shareholders (excluding the Promoter and Promoter Group)	7 (Seven) Equity Shares out of every 71 (Seventy One) fully paid-up Equity Share held on the Record Date.

Please note that there is no change in ratio of Buyback for Small Shareholders.

"As members of the Promoter and Promoter Group vide letters dated July 28, 2023 have expressed their intention not to participate in the Buyback, the Buyback Entitlement of

Letter of Offer, shall read as: "Acceptance of 100% Equity Shares from other Eligible Shareholders in the General

Capitalised terms used herein and not defined herein shall have the same meaning as ascribed in the Letter of Offer.

Place: Mumbai

Mr. Bipin Singh

ASSCHER ENTERPRISES LIMITED

(FORMERLY INDIAN SEAMLESS ENTERPRISES LIMITED) Regd. Office: 503, 5" Floor, Lunkad Sky Station Co-op Premises Society Limited,

Viman Nagar, Pune - 411014, Maharashtra. Tel.: 020-41255662 Website: www.isel.co.in E-mail: secretarial@isel.co.in CIN: U29000PN1995PLC090946

NOTICE

Notice is hereby given that the 27" Annual General Meeting ('AGM') of Asscher Enterprises Limited (Formerly Indian Seamless Enterprises Limited) ('Company') will be held on Wednesday September 27, 2023 at 11:30 AM through video conference ('VC') / Other Audio Visual Means ('OAVM') in compliance with the applicable provisions of Companies Act, 2013 ('Act') and rules made thereunder read with Ministry of Corporate Affairs vide latest General Circular dated 28th December 2022 permitted to hold AGM through VC/OAVM without the physical presence of members at a common venue. Accordingly, the AGM is being held through VC/ OAVM facility for the same.

The Notice and Annual Report is being sent only by electronic mode to all those members whose email addresses are registered with the Company / Depositories in accordance with the applicable Circulars. Members can join and participate in the AGM only through

The Company is providing its members remote e-voting facility to cast their vote on all resolutions set forth in the AGM Notice. Additionally, the Company is providing the facility of voting through the e-voting system ('e-voting') during the AGM. The business may be transacted through voting by electronic means. The Company has availed the service of CDSL for providing remote E-voting/E-voting during AGM.

Members participating through the VC/OAVM facility will be counted for the purpose of reckoning the quorum under the Section 103 of the Act. The Notice and Annual Report is being available on Company's website www.isel.co.in

and also on website of CDSL at www.evotingindia.com

Members holding shares in physical as well as dematerialized form and who have not registered their email addresses with the Company / Depositories can obtain Notice of the AGM, Annual Report and/or Login Details for joining the AGM through VC/OAVM facility including E-voting by sending scanned copy of (a) Copy of Signed request letter confirming Folio No., name & address of Members (b) Self-attested PAN copy (c) Selfattested documents of any one (Aadhar Card, Driving license, Election voting Card or Passport) either to Company's Registrar and Share Transfer Agent "Link Intime India Private Limited" at rnt.helpdesk@linkintime.co.in or to the Company at secretarial@isel.co.in. The detailed instructions to join the AGM through VC/OAVM and to cast the vote through remote e-voting / e-voting are contained in Note No. 17 of Notice

The remote e-voting commences on September 24, 2023 (9:00 am) and ends on September 26, 2023 (5:00 pm). Remote e-voting shall not be allowed beyond 5:00 pm

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut-off date i.e., September 20, 2023 shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM. In case of persons who became members of the Company after dispatch of AGM Notice may write to mt.helpdesk@linkintime.co.in or secretarial@isel.co.in for obtaining login ID & password. However, in case he/she already registered with NSDL/CDSL for remoteevoting then he/she can use his/her existing User ID & Password for casting the vote. A Member may participate in AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the AGM. The facility for e-voting shall be

made available at the AGM. In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ('FAQs') and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com.

(Formerly Indian Seamless Enterprises Limited) Place: Pune Anchal Jaiswal Date: September 1, 2023 Company Secretary

LOKNETE BABURAO PATIL AGRO INDUSTRIES LIMITED

CIN: U74110PN2012PLC141952

Regd Office: Laxminagar, Angar, Taluka Mohol, Solapur – 413214

Tel. No.: (02189) 248699, 248799 E-mail: loknetesugar@gmail.com

NOTICE OF THE 12" ANNUAL GENERAL MEETING

AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 12th Annual General Meeting (AGM) of the

Members of Loknete Baburao Patil Agro Industries Limited (the "Company")

will be held on Friday, 29th September, 2023 at 1:00 p.m. at Laxminagar,

Angar, Taluka Mohol, Solapur, 413214 to transact the businesses as set out in

The copy of Notice of the AGM and instructions for remote e-voting, along with

attendance slip, proxy form and the Annual Report for the financial year

2022-23, has been sent to all the Members at their registered addresses

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013, read with

the Rules made thereunder, Secretarial Standard-2 (SS-2) on "General

Meetings", issued by the Council of the Institute of Company Secretaries of

India (including any statutory modification(s) or re-enactment thereof for the

time being in force), the Company is pleased to provide the facility to its

Members holding shares as on Cut-off date being, Friday, 22" September, 2023

to cast their votes by electronic means or ballot/polling paper on all resolutions

set forth in the Notice of AGM. The Members may cast their votes

using an e-voting system from a place other than the venue of the Meeting

('Remote E-voting'). The Company has engaged National Securities

Depository Limited (NSDL) to provide Remote E-voting facility. The details of

Remote E-voting facility pursuant to the provisions of the Companies Act, 2013

1. Date of completion of dispatch of Notice of AGM along with the Annual

The Remote E-voting period will commence on: Tuesday, 26" September,

4. A person whose name is recorded in the Register of Members as

maintained by the Registrar and Share Transfer Agent as on the cut-off date

i.e. Friday, 22rd September, 2023 only shall be entitled to avail the facility of

Any person, who becomes Member of the Company after dispatch of the

Notice of AGM and holding shares as on the Cut-off date may obtain user id

and password for Remote E-voting by sending a request at

evoting@nsdl.co.in or lokneteagro77@gmail.com. However, if a person is

already registered with NSDL for e-voting, then existing user id and

Remote E-voting shall not be allowed beyond 5.00 p.m. on Thursday,

The facility of voting through 'Ballot Paper' or 'Polling Paper' shall be

made available at the AGM to the Members who have not casted their

. A Member can opt for only one mode of voting i.e. either through

Remote E-voting or through ballot or polling paper at the AGM. If a

Member casts his/her vote by both modes, then, voting done through

Remote E-voting shall prevail and the ballot/polling paper shall be

treated as invalid. Please read the instructions given in the notes to the

Notice of the AGM carefully before voting electronically. Any person

who is not a Member as on the cut-off date should treat this Notice for

A Member may participate in the AGM even after exercising the right to

vote through Remote E-voting but shall not be allowed to vote again at

the AGM. Kindly note that vote once casted cannot be modified.

Punde & Associates, Company Secretaries, as the scrutinizers to

scrutinize Remote E-voting process and voting at the AGM in a fair and

. The Notice of AGM shall be available on the NSDL website

For any queries / grievances relating to Remote E-voting, Members are

requested to refer the 'Frequently Asked Questions' (FAQs) for Members and

Remote E-voting user manual available in the 'download' section of

www.evoting.nsdl.com or write to Mr. Rajshekhar Gaikwad, EDP-Manager, at

the Registered Office of the Company or contact him on +91-9922449846 or

send email at lokneteagro77@gmail.com or evoting@nsdl.co.in or call on toll

NOTICE is also hereby given pursuant to Section 91 of the Companies Act,

2013 and applicable rules thereunder that, the Register of Members and share

transfer book of the Company will remain closed on Friday, 22" September,

2023 for the purpose of determining the entitlement of Preference Share

. The Company has appointed Mr. Vishvas Bokil, Partner, M/s Bokil

2023 at 9:00 a.m. and shall end on Thursday, 28" September, 2023 at

the Notice convening the AGM.

registered with the Company in the permitted mode.

and Rules made thereunder are as follows:

5:00 p.m.

Report: Saturday, 02" September, 2023.

The Cut-off date shall be: Friday, 22rd September, 2023.

Remote E-voting as well as voting at the AGM.

password can be used for casting votes.

vote through Remote E-voting.

information purposes only.

www.evoting.nsdl.com

free No.: 1800-1020-990.

The Members are also informed that:

28" September, 2023.

Reg. Office Address: Room No. 144, C-Wing, Nirman Bhawan, Maulana Azad Road New Delhi,110001 CIN: L70101DL2005GOI132162

Website: www.hpil.co.in

Email: info@hpil.co.in

HEMISPHERE PROPERTIES INDIA LIMITED (A Government of India Enterprise)

हेमीस्फेयर प्रॉपर्टीज इंडिया लिमिटेड (भारत सरकार का उपक्रम)

NOTICE 19th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 19th Annual General Meeting (AGM) of the members of the Company will be held on Wednesday, the 27th September, 2023 at 12:00 noon (IST) through Video Conferencing (VC)/ Other Audio-Visual Means (OAVM) to transact the business as set out in the notice

The Ministry of Corporate Affairs (MCA) vide circular dated 28th December, 2022 SEBI vide Circular dated 5th January, 2023 read with other relevant circulars of MCA/ SEBI, permitted the holding of AGM through VC/OAVM, without the physical presence of members at common

The 19th Annual Report of the Company for FY 2022-23 is being sent through electronic mode to the members whose email address are registered with the Depositories/ Registrar & Transfer Agent, in compliance of the SEBI circulars. Further, notice of AGM and Annual Report are also available on the website(s) of Company at www.hpil.co.in, websites of Stock Exchange(s) i.e. National Stock Exchange of India Limited www.nseindia.com and BSE Limited i.e. www.bseindia.com and website of NSDL at www.evoting.nsdl.com Members who have not registered their e-mail address so far, or want to change their e-mail

ids, are requested to register/ change the same with their Depository Participant RTA, so as to receive all communications electronically SEBI vide circular dated 16th March, 2023 mandated all the holders of physical securities to furnish their PAN, nomination, contact details, Bank A/c details and specimen signatures for

their corresponding folios by 01st October, 2023 to M/s TSR Consultants Private Limited Registrar and Transfer Agents (RTA) In compliance of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (_ODR) Regulations, 2015 as amended, the Company is pleased to offer e-voting facility (both remote

e-voting and voting at the time of AGM) through the NSDL to all the eligible members in respect

of all the items to be transacted at AGM through voting by electronic means, whose names are

recorded in the Register of Members (holding in physical form) or in the Register of Beneficial Owners maintained by the Depositories (holding in electronic form) on Wednesday, the 20th September, 2023 (cut-off date). The remote e-voting period shall commence on Sunday, the September 24, 2023 (9:00 a.m. IST) ends on Tuesday, the September 26, 2023 (5:00 p.m. IST) and members shall not be allowed to vote thereafter. Remote e-voting shall not be allowed beyond the said date and time. Those members, who do not cast their vote on the resolutions through remote e-voting during the above period and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. Further, members who have cast their vote by remote e-voting may attend the AGM, but shall not be entitled to change it subsequently or vote again

at the AGM. Any person whose e-mail ID is not registered with the Company/DP or who

becomes a member of the Company after dispatch of the Notice of AGM and holds shares as

on the Cut-Off date, may obtain the user ld and password for e-voting by sending a request at: evoting@nsdl.com with a copy marked to info@hpil.co.in. urther, the Company has appoint CS Rahul Chaudhary (ACS 54713) of M/s Rahul Chaudhary & Associates as Scrutinizer for conducting the electronic voting process prior to the AGM and during the AGM, in a fair and transparent manner. Members who would like to express their views/ask questions as a speaker at the Meeting may pre-register themselves by sending a request from their registered e-mail address mentioning their names, DP ID and Client ID/folio number, PAN and mobile number at agm@hpil.co.in or info@hpil.co.in latest by 6.00 p.m.

(IST) on Wednesday, 20th September, 2023. The Company reserves the right to restrict the number of speakers depending on the availability of time for the AGM In case of any queries, members may refer the Frequently Asked Questions(FAQs) for shareholders and e-Voting user manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or refer to instructions as mentioned in the notice of 19th AGM or call

at 022 -4886 7000 and 022 - 2499 7000 or send a request at evoting@nsdl.co.in or contact

Ms. Pallavi Mhatre, Manager, NSDL at paliavid@nsdlco.in.

For Hemisphere Properties India Limited Date: 31.08.2023 Lubna

Company Secretary & Compliance Officer Place: New Delhi

NARBADA GEMS AND JEWELLERY LIMITED

Regd Office.: 3-6-291/4/B, 2ndFloor, Hyderguda, Hyderabad- 500 029, Ph:040-48506411, E-mail:comsec@narbadajewellery.com, website:www.narbadajewellery.com; CIN: L01222TG1992PLC014173

NOTICE OF THE 31st ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 31st Annual General Meeting (AGM) of the Members of Narbada Gems and Jewellery Ltd ('Company') will be held through Video Conferencing ("VC") or Other Audio -Visual Means ("OAVM"), on 21st September, 2023 at 03:30 PM IST to transact the Ordinary & Special Business as detailed in the Notice dated 10th August.

The Ministry of Corporate Affairs (MCA) has, vide its circular dated January 13, 2021, read together with circulars dated April 8, 2020, April 13, 2020, and May 05, 2020, (collectively referred to as "MCA Circulars") and the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, allowed convening the AGM through Video Conferencing or Other Audio-Visual Means, without the physical presence of the Members at a common venue. Hence, the AGM of the Company is being held through VC/OAVM. **Notice of AGM and Dispatch**

In terms of the Section 101 of the Companies Act, 2013 read with Rule 18 of the Companies

(Management and Administration) Rules, 2014, the aforesaid Notice and the Annual Report (including Financial Statements) for the Financial Year 2022-2023 have been sent through e-mail to all the Members whose e-mail addresses are registered with the Depository Participant(s) (DP)/Registrar & Transfer Agent (RTA) / Company on 29th August, 2023. The Annual Report along with AGM Notice is available on the Company's website at www.narbadajewellery.com and also on www.evotingindia.com, www.bseindia.com. Members who have acquired shares in the Company after the said date, or who have not registered their e-mail address with the DP/RTA/Company can access the Annual Report on the above websites and send a request to your DP/RTA/Company for receipt of the same along with e-voting details

Closure of Register of Members and Share Transfer Books NOTICE is further given pursuant to Section 91 of the Companies Act, 2013 that

the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Thursday, 14th September, 2023to Thursday, 21st September, 2023 (both days inclusive) for the purpose of Annual General Meeting. Members and all other persons concerned are hereby requested to take note of the same and lodge the share transfer deed(s), if any, duly executed, with the Registrar & Transfer Agent (RTA) and also notify change in their address/bank account particulars, if any, to the RTA (in respect of shares held in physical form) or directly to their Depository Participant(s) (in respect of shares held in demat form) on or before 14th September, 2023 ("cut off date"). All shareholders holding shares as on cut off date shall be eligible to cast their vote and attend the AGM of the Company. Manner of Voting at the AGM (remote e-voting and e-voting at AGM)

NOTICE is further given that in compliance with Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing e-voting facility (remote e-voting and e-voting at the AGM) to all its Shareholders to enable them

Members will be able to cast their vote electronically on the businesses as set forth in the Notice of the AGM either remotely (during the remote e-voting period) or during the AGM (when the window for e-voting is activated upon instructions of the Chairman).

to cast their votes on all matters listed in the said Notice through electronic means.

Cut-Off Date for determining the Members Thursday, 14th September, 2023 entitled to vote through e-voting Commencement of e-voting period Monday, 18th September, 2023 (9:00 AM) Wednesday, 20th September 2023(5:00 PM) End of e-voting period

The members who cast their vote through remote e-voting may attend the AGM but will not be allowed to vote again at the AGM. The detailed instructions for casting the vote through e-voting is attached to the AGM Notice as well as available on the Company's website on www.narbadajewellery.com and on websites at www.evotingindia.com and www.bseindia.com.

Any person who becomes a Member of the Company after the dispatch of the Notice convening the AGM and holds shares as on the cut-off date may obtain the LOGIN ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com or rta@cilsecurities.com. However, if such person is already registered with CDSL for e-voting then he/she can use his/her existing USER ID and password for casting vote. Any person who is not a shareholder as on the cut-off date may consider this notice for informational purposes only. **Attendance to the AGM through VC/OAVM:**

Members are requested to note, that in view of the MCA Circulars, the Company

is pleased to provide attendance to the AGM through VC/OAVM facility. The Shareholders will be required to login on **www.evotingindia.com** using their e-voting User ID and password. The link to view and participate in the AGM proceedings will be available on www.evotingindia.com. The details for participation to the AGM,

registration as a Speaker and to ask questions on the agenda for the AGM are included in the Notes to the AGM Notice. The members are requested to refer the same in detail. Members who have not updated their e-mail addresses are requested to update the same with their DP by sending a written request by email to rta@cilsecurities.com. In case of any queries/grievances, connected with facility for voting by electronic means, please contact Mr. Hussain M, Registrar and Share Transfer Agent (RTA) of CIL Securities Limited via email at rta@cilsecurities.com or please contact

Mr. Rakesh Dalvi, Sr. Manager, and CDSLemail; evoting@cdslindia.com or

The instructions for e-voting and participation in the AGM shall also form a part of the AGM Notice of the Company, which shall be available on the website of the Company, CDSL and the Stock Exchange. This Advertisement is being published in compliance of the MCA Circulars and for the information of the members as is available on the Stock Exchanges website and the website of

We urgeall members to update their information at the earliest to receive the AGM Notice, Annual Report and e-voting credentials (as applicable).

> For Narbada Gems and JewelleryLimited Sanjay Kumar Sanghi

By Order of the Board of Directors

Date:31.08.2023 Place:Hyderabad Managing Director DIN: 00629693



3i Infotech'

3i Infotech Limited Corporate Identification Number (CIN): L67120MH1993PLC074411 Registered office: Tower # 5, International Infotech Park, Vashi, Navi Mumbai 400703.

Tel No.: (022)7123 8000 | Email: investors@3i-infotech.com | Website: www.3i-infotech.com NOTICE OF THE 30™ ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 30th Annual General Meeting ("AGM") of the Members of 3i Infotech Limited (the "Company") will be held on Monday, September 25, 2023 at 11:30 a.m. (IST) through Video Conferencing ("VC") Other Audio-visual Means ("OAVM") to transact the business as set out in the notice of AGM dated July 28, 2023, in compliance with the applicable provisions of the Companies Act, 2013 (the "Act") and rules framed thereunder read with Ministry of Corporate Affairs, Government of India ("MCA") General Circular No. 11/2022 dated December 28, 2022, General Circular No. 2/2022 dated May 5, 2022 read with circulars dated December 31, 2020, September 28, 2020, June 15, 2020, April 13, 2020 and April 8, 2020 (collectively referred as "MCA Circulars") and the Securities and Exchange Board of India ("SEBI") vide circulars dated January 5, 2023, May 13, 2022, January 15, 2021 and May 12, 2020 (collectively referred as "SEBI Circulars") without the physical presence of the Members at a common venue. For the purpose of the AGM, National Securities Depository Limited ("NSDL") will be providing the necessary facility for voting through remote electronic voting ("remote e-voting") and for participating in the AGM through VC / OAVM facility and voting through electronic voting system during the

AGM, procedure and instructions for e-voting and Annual Report for the financial year 2022-2023 ("Notice and Annual Report") will be sent by e-mail to all those Members whose names appear in the register of Members and whose e-mail address(es) are registered with the Company or the Registrar and Share Transfer Agent or the Depository Participant(s) as on the record date i.e. Friday, August 25, 2023 and physical copy of the Notice and Annual Report will be sent only to those Members who specifically request for the same. Members who have not registered their e-mail address and mobile numbers are requested to register the same in respect of shares held in electronic form

Pursuant to provisions of Sections 101 and 136 of the Act and rules made

thereunder and in terms of MCA Circulars and SEBI Circulars, the notice of

meeting ("e-voting")

Date: September 1, 2023

Place: Navi Mumbai

with the Depository through their concerned Depository Participant and in respect of shares held in physical form, by writing to the Company's Registrar and Share Transfer Agent. The copy of the Notice along with the Annual Report will also be available on the website of the Company, viz. www.3i-infotech.com and on the websites of

available on the website of NSDL i.e. www.evoting.nsdl.com Members will be provided with the facility to cast their votes on all resolutions set out in the Notice of the AGM using remote e-voting or through e-voting during the AGM. Detailed procedure for remote e-voting / e-voting at AGM will be provided in the Notice of the AGM. Members can attend the AGM through VC / OAVM facility only by following procedure as set out in the Notice of the AGM. In terms of SEBI Circular dated December 9, 2020, on e-voting facility provided by listed Companies, Individual Members holding securities in demat mode are

allowed to vote through their demat account maintained with Depositories and

Depository Participants. Members are required to update their mobile

number and e-mail address correctly in their demat account in order to access e-voting facility. For any queries or grievances relating to remote e-voting, Members may please contact Mr. Amit Vishal, Assistant Vice President or Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL, Trade World, 'A' Wing, 4" Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai – 400 013 or at

(022) 48867000 and (022) 2499 7000 or evoting@nsdl.co.in. By Order of the Board of Directors

> Varika Rastogi Company Secretary

Welspun INDIA LIMITED Regd. Office: Welspun City, Village Versamedi, Taluka Anjar, Dist. Kutch, Gujarat - 370110 Tel: +91 2836 661111 Fax: +91 2836 279010

Corp. Office: Welspun House, 6th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai, Maharashtra - 400013 Tel: +91 22 66136000, Fax: +91 22 24908020 E-mail: companysecretary_wil@welspun.com; Web: www.welspunindia.com NOTICE

Notice is hereby given that the 38th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Friday, September 22, 2023 at 11.00 a.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business

as set out in the Notice of the AGM only through e-voting facility. The AGM will be held only through VC / OAVM in compliance with the provisions of the Companies Act, 2013 and circulars issued by the Ministry of Corporate Affairs and SEBI The facility for appointment of proxy will not be available for the AGM. The instructions for

joining the AGM electronically are provided in the Notice of the AGM. In Compliance with the General Circular No. 10/2022 dated December 28, 2022, read with earlier Circulars issued from time to time by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 read with earlier Circulars issued from time to time by the SEBI (hereinafter collectively referred to as "the Circulars"), electronic copies of the Notice of the AGM and the Annual Report 2022-23 have been sent to all the members whose e-mail IDs are registered with the Company Depository Participant(s). These documents are also available on the website of the

Company at www.welspunindia.com and on BSE Limited and National Stock Exchange of

India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of the National Securities Depositories Limited at www.evoting.nsdl.com. The Company has completed the dispatch of Notice of AGM and the Annual Report 2022-23 through electronic mode on August 31, 2023 to all the eligible members of the Company. Members who have not registered their e-mail addresses are requested to register their email addresses with respective depository participant(s) and members holding share in physical mode are requested to update their e-mail addresses with Company's Registral and Share Transfer Agent, Link Intime India Private Limited at rnt.helpdesk@linkintime.co.in. Members holding share in physical form or dematerialized form, as on the cut-off date i.e

Friday, September 15, 2023, may cast their votes electronically on the business as set forth in the Notice of the AGM through the electronic voting system of NSDL ('remote e voting'). The Company has appointed Ms. Mansi Shah of M/s. JMJA & Associates Company Secretaries (Certificate of Practice No. 8120), Mumbai as Scrutinizer to scrutinize the voting and remote e-voting process. The details of remote e-voting process are as under:

(a) The Company has completed the dispatch of Notice of AGM on August 31, 2023 and the business as set forth in the Notice of the AGM may be transacted through remote e voting and e-voting system at the AGM; (b) Remote e-voting will commence on Tuesday, September 19, 2023 (9:00 a.m.) and

ends on Thursday, September 21, 2023 (5:00 p.m.);

(c) The Cut-Off Date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be Friday, September 15, 2023;

(d) Remote e-voting module will be disabled on Thursday. September 21, 2023 at 5:00 p.m. i.e., remote e-voting will not be allowed beyond the said date and time; (e) Members may note that the facility for voting will also be made available during the AGM, and those Members who will attend the AGM through VC/OAVM facility and

have not caste their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system (f) The voting rights of members shall be in proportion to their shareholding as on the cutoff date of September 15, 2023;

(g) Any person, who acquires shares of the Company and becomes member of the

Company after dispatch of the notice and holds shares as of the cut-off date i.e. September 15, 2023, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or to the Company/Registrar & Transfer Agent. However, if you are already registered with NSDL or CSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote.

(h) A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to vote on the resolutions to be passed at AGM; (i) The members who have cast their vote by remote e-voting prior to the AGM may also

attend the AGM, through VC/OAVM, but shall not be entitled to cast their vote again.

(j) Notice of the AGM and procedure for remote e-voting is available on the Company's website www.welspunindia.com and the website of NSDL at www.evoting.nsdl.com; (k) Members may contact Mr. Shashikant Thorat, Company Secretary, at 4th Floor,

Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel Mumbai - 400013, or email at companysecretary wil@welspun.com or call on +91 (022) 66136000 between 11:00 a.m. and 6:00 p.m. on any working day. All grievances connected with the facility for voting by electronic means may be addressed to NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 022 -

4886 7000 or 022 - 24997000. Notice to the shareholders who have not en-cashed dividend for last seven consecutive years.

Pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016 which have come into effect from September 7, 2016 and amended from time to time, this is to inform to those shareholders who have not en-cashed the dividend or who's dividend remained unclaimed for last seven consecutive years then those shares shall be transferred to the "Investor Education and Protection Fund" (IEPF) i.e. a fund constituted by the Government of India under Section 125 of the Companies Act, 2013. The names of such shareholders and their folio number or DP ID - Client ID will be available on the website of the Company at www.welspunindia.com.

To claim unpaid / unclaimed dividend or in case you need any information/clarification please write to or contact to the Company's Registrars and Transfer Agent or The Company Secretary of the Company at the Registered Office or at the Corporate Office address.

For Welspun India Limited

Mumbai, August 31, 2023

Company Secretary

Shashikant Thorat

Date: September 1, 2023 financialexp.epap.in

*For further information on Ratio of Buyback as per the Buyback Entitlement in each Paragraph 19.5.5 on Page 56 of the Letter of Offer shall be replaced with:

19.5.5.1 Fifteen percent of the number of Equity Shares which the Company proposes to Buyback i.e., 15% of 1.40.00.000 (One Crore Forty Lakh only) Equity Shares which is

Paragraph 19.5.5 on Page 56 of the Letter of Offer shall be replaced with:

* The above Ratio of Buyback is approximate and provides indicative Buyback Entitlement. Any computation of entitled Equity Shares using the above Ratio of Buyback may provide a slightly different number due to rounding-off. The actual Buyback Entitlement factor for Reserved category for Small Shareholders is 14.888791363367% and General category for all other Eligible Shareholders (excluding the Promoter and Promoter Group) is

4. The change set out in Paragraph 3 of this Second Corrigenda shall also be applicable to the 5. In Paragraph 19.9.1.1 on Page 59 of the Letter of Offer the following sentence is to be

Promoter and Promoter Group will be available for Eligible Shareholder who validly tender Additional Equity Shares over and above their respective Buyback Entitlement". 6. Following the deletion of the aforesaid sentence, Paragraph 19.9.1.1 on Page 59 of the

Category who have validly tendered their Equity Shares, to the extent of their Buyback Entitlement, or the number of Equity Shares tendered by them, whichever is less". All other contents and other terms in the Letter of Offer remain unchanged.

For Piramal Enterprises Limited

VIKRANT RAJAN PATIL Date: 02" September, 2023 Place: Angar, Solapur Company Secretary

Holders to the dividend if declared by the Members at the AGM.

Managing Director DIN: 02450106

By order of the Board of Directors

Loknete Baburao Patil Agro Industries Limited

call 1800225533.

the Stock Exchanges where the equity shares of the Company are listed i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and also

–જ્યારે સગીરાએ શિક્ષણ મેળવવા ઘર છોડ્યું

ભુજ, તા. ૧ : ભારત દેશનું સૂત્ર છે 'દરેક બાળકને શિક્ષણનો અધિકાર', પરંતુ કચ્છજેવા દુર્ગમ વિસ્તારમાં શ્રમજીવી એવા અનેક અશિક્ષિત માતા-પિતાનાં આશાલત માતા-ાપતાના બાળકોને શાળાપ્રવેશ અથવા સીધા દસમાં ધોરણની પરીક્ષામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ન કરી પ્રવશ માટના પ્રાક્ર્યા ન કરા શક્વાથી અનેક બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે... પરંતુ ભુજની ત્રિજ્યાના ૨૦ કિ.મી. અતરના એક નાના ગામથી ભણાવાની જીદ લઇને એક સગીરા અડથી રાતે ઘર મૂકી ભુજ તરક પગે નીકળી પડી હતી. જો કે, આ ૨ખડતી-ભટકતી જીદી બાળાને સહીસલામત વાલીઓને ૧૮૧ની અભયમ્ટીમે સોંપી

હતા. આ અંગે પશ્ચિમ કચ્છની ૮૮૧ અભયમ્ ટીમ પાસેથી મળેલી જાણકારી મુજબ ગત તા. ૨૯/૮ના એક જાગૃતે ૧૮૧ મહિલા હેલ્યલાઇન પર કોલ કરી જણાવ્યું કે, અંદાજે ૧૫-૧૬ વર્ષની કિશોરી એકલી બેઠી છે. ટીમના કાઉન્સેલ૨ ગુપ્તા, પો.કો.

રેખાબેન પટેલ અને પાઈલટ ભાવેશભાઇ ખંભુ ત્યાં પહોંચ્યા. કિશોરી સાથે વાતચીત કરતાં તેણે

ભુજ નજીક બનેલી ઘટનામાં અભયમૃની ટીમે બજાવી ફરજ

ટીમને ચોખ્ખું જશાવી દીધું કે મારે ઘરે જવું નથી, મારે આશ્રમ જવું છે... પ્રથમ પીડિતાએ ઓળખ છુપાવવા ખોટા નામ-સસ્નામાં આપ્યાં પરંતુ ટીમે સંવેદનશીલ બન્ની કિશોરીનો વિશ્વાસ સંપાડિત કરી વાતચીત કરતાં સમગ્ર ચિગાતી સામે આવી હતી માતા-પિતા શાળાએ મોકલતા ન હતા. તેની બહેનપશીએ જણાવ્યું કે, કોઇ આશ્રમમાં રહેવાની અને ભણવાની સુવિધા મળે છે. આથી પરિવાર સૂતો હતો ત્યારે રાત્રે ૩ વાગ્યે ઘરેથી ચાલતાં ૨૦ કિ.મી.

સુધી દૂર નીકળી ગઇ હતી. અભયમ્ ટીમની ઘણી પૂછપરછ બાદ કિશોરીએ પોતાના ગામ અને માતા-પિતાની વિગતો

તેના ઘરે પહોંચતાં ક્રિશોરીને જોઇ માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા અને કિશોરીને ભેટી પક્ષા હતા

. ૧૦૧૧ હતા. અભયમ ટીમે માતા-પિતા દ્વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓના આઠ સંતાનો છે જેમાં આ કિશોરી સૌથી નાની છે અને શાળામાં ભણતી નથી, પણ તેને ભણવાની અત્યંત ઈચ્છા છે. વાલી પાસે પૂરતાં પ્રમાણપત્રો ન હોવાથી શાળામાં મોકલી શક્યા ન હતા. હવે શાળામાં તેની ઉંમર ન હતા. હવે શાળામાં તના ઇમર પ્રમાણેનાં ઘોરણમાં મૂકવા માટે શાળાએ સોગંદનામું માગ્યું હતું. માતા-પિતા અસ્વસ્થ હોઇ સોગંદનામું કરવામાં મોડું થઇ ગયું હતું. બીજીતરફ પીડિત દિશારીએ માતા પાસે જીઠ કરતાં માતાએ ઠપકો આપતાં કિશોરી ભણવાની જીદ પકડીને અડધી રાતે ઘર મૂકી પગે ચાલી નીકળી હતી. માતા-પિતા સવારથી જ કિશોરીની શોધખોળ કરતા હતા. અંતે અભયમ્ ટીમે ખરાઇ કરી કિશોરીને માતા-પિતાને સોંપી

વાવાઝોડામાં કામગીરી કરનારા

કર્મચારીઓને થયું રક્ષાબિધન ભુજ, તા. જે: બિપોરજોય ભુજ, તાં. જે: બિપોરજોય ભાગમાં મૃકી અને વીજળી પુરવઠો (ઇલેક્ટ્રિસિટી) તુરંત ચાલુ કરી દેનારા પીજીવીસીએલના બ્રિઝાડીઓને જ્યારા નારીશર્સિ દનારા યાજનાસાનના કર્મચારીઓને જીવદયા નારીશક્તિ ગ્રુપ દ્વારા રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાખડી બાંધી તેમજ દીઘાર્યુની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

શુભ્યજી પાઠેવવામાં આવા હતા. આ કાર્યક્રમમાં વિભાગના સબડિવિઝનના નાયબ ઇજનેર તૃપ્તિ મક્વાશા તથા સ્ટાકના બહેનોએ નારીશક્તિના સભ્યોનું સ્વાગત કર્યું હતું, જેમાં સંસ્થાના ગીતાબન રાઠોડ, કંચન જોશી, રેશ્મા શાહે શુભેચ્છા પાઠવી હતી.



એસ.ટી.ની નોકરી માટે આરટીઓમાં ધસારો : એસ.ટી. દ્વારા કંડક્ટરના પદ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરાયાને પગલે ભુજ આરટીઓમાં દરરોજ સેંકડો નોકરીવોચ્છુઓનો લાયસન્સ મેળવવા ધસારો થતો હોય છે. અરજદારોની હાલાકી ઓછી કરવા તંત્ર હારા સાતમી સપ્ટેમ્બર સુધી વધારાના ઇન્સ્પેક્ટર-ક્લાર્કની કાળવણી કરવામાં આવી હોવાનું આ અંગે રજૂઆત કરનારા મોટરિંગ પલ્લિકના ઉમર સમાએ જણાવ્યું હતું. (**તસવીર : મયૂર ચૌહાણ**)

હતી, જેમાં ઓફિસનાં નિષયાં ખસેડી તેમાં રહેલા રૂા. ૧૦૦૦૦ અને રૂા. ૧૨૦૦૦ની કિંમતના બે

૧૨૦૦૦ના કિમતના બ લેપટોપ, ચાર્જર તથા બેગ સહિત કુલ રૂા. ૨૨૦૦૦ના મુકામાલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીનો મુકામાલ હસ્તગત કરી આરોપી સામે કાયદેસરની

ભુજમાં થયેલી લેપટોપ ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ, તા. ૧ : શહેરના શૌચાલયમાં કામ કરતા રાકેશ સરપટનાકા વિસ્તારમાં આવેલી ગોવિંદભાઈ પરમાર પર શંકા સેતુ માહિતી કેન્દ્રની જતાં પોલીસે તેની પૂછપરછ કરી

સેતુ માહિતી કેન્દ્રની ઓફિસમાંથી ગુરુવારે બે લેપટોપ કિં. રૂા. ૨૨૦૦૦ની ચોરી કરનારો આરોપી ઝડપાઈ જતાં

ભુજ શહેર એ - ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી

લાધા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, ચૌહાણ ટી હાઉસ પાસેની ઓફિસમાંથી ચોરી કરનારા આરોપીની શોધ અર્થે

કરનારા આરોપીની શોધ અર્થે આરોપી સામે બનાવસ્થળની બાજુમાં આવેલા કાર્યવાહી કરી હતી.

પશ્ચિમ રેલવે – અમદાવાદ ડિવિઝન

નં.MD/SBI/173/LAB ગાંધીધામની ખાનગી પેથોલોજીકલ લેબોરેટરીઓ તરફથી

ભુજના ચેક પરત ફરવાના કેસમાં આરોપીને કેદ

ભુજ , તા. ૧ : બેંકમાંથી રૂા. ,૦૦,૦૦૦નો ચેક પરત ફરવાના કેસમાં એડિશનલ જ્યુડિશિયલ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા આરાપાન અક પવના સાઠા કદ તથા ચેકની ૨કમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદી વિશાલ પ્રતાપભાઈ ગોસ્વામીને મહિન્દ્રા શો રૂમમાં નોકરી કરતા રસિક ભીમભારથી ગોસ્વામીએ રૂા. ભીમભારથી ગોસ્વામીએ રૂા. ૨,૦૦,૦૦૦નો ચેક આપ્યો હતો. જે વિશાલભાઈએ બેંકમાં નાખતાં

11 3 તમાં ગાર પાંત્ર કર્યો હતો. આ બાબ તે બુજની કોર્ટમાં કેસ ચાલતા જજ એન ની ગુનાએ બંને પશ્વની દલીલ સાંભળી આરોપી બીમબારથી વિરૃદ્ધ વુકાદો આપતા એક વર્ષની સાદી કેદ અને 30 દિવસમાં ચેકની રક્ષ્મ વળતરરૂપે પરત કરવા અને તેમ ન કરે તો વધુ ત્રણ માસની ચાર્ક કરતાં વધુ હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ પ્રતાપ એસ. સૌસી હાજર રહ્યા હતા.

અંજારમાં આંકડાના જુગારના બે દરોડા પડાયા : બે ઝડપાયા

ગાંધીધામ, તા. ૧ : અંજારમાં ગંગાનાકા સર્કલ તથા સરકારી હોસ્પિટલ નજીક જાહેરમાં આંકડાનો જુગાર લેતા બે શખ્સને પોલીસે પકડી પાડી રોકડરૂા. ૮૦૦ જપ્ત કર્યા હતા. અંજારના ગંગાનાકા સર્કલ પાસે જાહેરમાં આંકડો લેતા સિકંદર પાસ ક્રાહરના આડડા લતા ભાકર ઇબ્રાહીમ આરભને પોલીસે પકડી પાડ્યો હતો. તેની પાસેથી રોકડ રૂા. ૪૧૦ તથા આંકડાનું સાહિત્ય જપ્ત

કરાયું હતું, તેમજ આ જ શહેરની સરકારી હોસ્પિટલ નજીક ચાની રેંકડી પાસે આંકડો લેતા મનીષ રેવા ભીલને પણ પોલીસે પકડી પાડ્યો હતો. લોકો પાસેથી આંકડો લેતા આ શખ્સ પાસેથી રોકડ રૂા. ૩૯૦ તથા આંકડાનું સાહિત્ય હસ્તગત કરાયું હતું. પકડાયેલા આ શખ્સો ઉપર કોને આંકડો લખાવતા હતા તે બહાર આવ્યું નથી.



GE LLCU
Single Received
GUJARAT ENERGY TRANSMISSION CORPORATION LIMITED

The Property of the Compound on Bhuj Road, Anjar-Kutch-370110 Transmission Circle Office Anjar, 220KV Anjar S/S compound on Bhuj Road, Anjar-Kutch-370110. mail : seanjar.getco@gebmail.com

વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીક્લ આસિસ્ટન્ટ)ની લેખિત પરીક્ષ બાબત

વિધુત સહાયક (ઇલેક્ટ્રકલ આસિસ્ટન્ટ)ના ભરતીના ભાગરૂપે જેટલે અંતરાંત વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. ૦૬-૦૩-૦૦૩લી તા. ૧૩-૦૩-૦૦૧૩ દરમ્યાન બેવાયેલ પોલ ટેસ્ટમાં ઉત્તરીલે થયેલ તેમજ અન્ય ધારાધોરણો પરિપૂર્ણ કરતાં હોય તેવા ઉમેદવારોની વેખિત પરીક્ષા તા. ૦૯/૦૯/૨૦૨૩, શનિવાર, સવારે ૧૧:૩૦ કલાકલી ળપોરે ૦૧:૦૦ કલાક સુધી છમદાવાદ ખાતે વિવિધ કેન્દ્રો પર ચોષ્ત્રનાર છે. જે અંગેના કોલ લેટર અંગેની કહેવે દ્વારા રુપિ. એડી. પોસ્ માસ્ક્રતે રવાના કર્યું દેવામાં ઓવલે છે. તેમામ ઉમેદવારોને એકોની વિવિધ વર્તું અર્થને કરી દ્વારા મોળાવિ પર સંપર્ધ પણ કરવામાં આવેલ છે. પરીક્ષા અંગેની માહિતી જેટકોની વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમ છતાં હતુ પણ કોઈ લાયક ઉમેદવારોને કોલ લેટર મળેલ ન હોય તો તેઓએ સંવગ્ન વર્તુળ કચેરી ખાતેથી તાલ્કાલિક મેળવી લેવા

જણાવવામાં ગાય છે. પ્રસ્તુત પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક કીતે પુર્વી પાડવામાં આવી રહી છે અને ''પોલ કલાઈગીંગ રેસ્ટ'' સંગંધિત વર્તુળ કરોરી દ્વારા વીડિયોગાફી પણ કરવામાં આવેલછે તેના માર્કસ પણ ઉમેદવારોને જણાવી દેવામાં આવેલ છે. અત્રેની નિગમીત ક્યેરીના ધ્યાન પર આવેલ છે કે, આવી પરીક્ષા આપનાર ઉમેદવારોને ગેરમાર્ગે દોરી કેટલાક લેભાગુ તત્વો તેમને નોકરીમાં સમાવેશ કરવાની. ખોટી લોભામણી લાલગો આપી ઉમેદવારો પાસેથી આર્થિક લાભ મેળવતા હોર

તત્વા તત્ત્વન નાકરામાં તમાવાય કરવાના, ખાટા લાભાગણા લાલવા ઝાપા ઇમદવારા પાતેવા ઝાગ્રહ લાગ મ છે. ઝાશી આ સર્વે ઉમેદવારોને સુચિત કરવામાં આવે છે કે, ઝાવા કોઇ પણ પ્રતિભગમાં આવવું નહીં અને અ તત્વો દ્વારા જે કોઇનો પણ સંપર્ક સાધવામાં આવે તો તાતકાલિક નઇકના લાંચ રૂચવા વિરોધી ખાતાનો કે તા હોય તે સંબંધિત વર્તુળ કચેરીના એય. આર.ના વડાનો તાત્કાલિક સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. વારીખ : ૦૨-૦૯-૨૦૨૩ (કી એમ કાંગી)

પ્રવહન વર્તુળ કચેરી, અં

કોટડામાં બંધ ઘરનાં તાળાં તોડી ૪૧ હજારની મતાની તફડંચી

ગાંધીધામ, તા. ૧ : અંજાર તાલુકાના કોટડા ગામના હસ્તકલાનગર વિસ્તારમાં એક બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રૂા. ૪૧,૦૦૦ની મતાનો હાથ મારી ગયા હતા.

કોટડા ગામના હસ્તકલા નગરમાં મકાન નંબર ૦૨/૧૦૫માં રહેતા અને જૂની દુધઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક નગરમાં શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કરજ બજાવતા સીમાબેન ભૂરાભાઈ લોંચાએ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદીના ત્રણભાઈ પૈકીના મહેશભાઈ પોતાના સસરાના ઘરે ગયા હતા. ફરિયાદી અને તેમનો પરિવાર ગઈકાલે રાત્રે સુઈ ગયા બાદ આજે વહેલી

પરોઢે ફરિયાદી ઊઠયા હતા. પાડોશમાં રહેતા પોતાના ભાઈ મહેશના ઘર બાજુ જોતાં તેમનાં મકાનનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેથી ફરિયાદી ત્યાં જતાં મકાનના દરવાજાના તાળાં તૂટેલાં જણાયાં હતાં તેમજ અંદર રહેલી તિજોરી પણ તૂટેલી હતી અને સરસામાન વેરવિખેર

તિજોરીના ખાનામાં પ્લાસ્ટિકની થેલીમાં રહેલા દાગીના ચોરાઈ ગયા હોવાનું

પરિવારજનો બહાર ગયા ને પાછળથી તસ્કરોનું કૃત્ય : ચોરીના વધતા બનાવોથી લોકોમાં ચિંતા પ્રસરી

બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે તિજોરીમાંથી પહેરવાના ચાંદીના કાંબિયા નંગ-બે. પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર નંગ-બે તથા રોકડા રૂા. ૧૦૦૦ એમ કુલ રૂા ૪૧,૦૦૦ની મતાની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં વધી રહેલા ઘરકોડ ચોરીના બનાવોને કારણે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે આવા બનાવોનું શોધન કરવા તથા આવા બનાવો બનતા અટકે તે માટે પેટ્રોલિંગ વધારવા લોકો માંગ કરી રહ્યા છે.



ગુજરાત ખનીજ વિકાસ નિગમ લી. (ગુજરાત સરકારનું સાહસ)

E-mail : customer_care@gmdcltd.com Helpline: 6357425636/6359947641/0792791320017 ગ્રાહક રજીસ્ટ્રેશન માટે નોટીસ

ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ લિગ્રાઇટ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યની અગ્રણ ગુજરાત ખાજ લાકાસ નિષ્માં લાયદા લાયદા ટ્વાડાઇટ ઉત્પાદનમાં ગુજરાત રોજ્યના એપ્રાલા કેપની છે, જે ગુજરાત રોજ્યના સંખ્રાલા કેપની છે, ત્યારે ત્યું કર્યું કહ્યું કે કર્યું કહ્યું કે કર્યું કહ્યું કે કર્યું કહ્યું કે કર્યું કે કર્યું કે કર્યું કે કર્યું કે કર્યું કરાયદા કે કર્યું કે કર્યું કે કર્યું કે કર્યું કે કર્યું કે કર્યું કરાયદા કે કર્યું કે કર્યું કે કર્યું કે કર્યું કે કરાયદા કરાયદા

મુલાકાત લેવી. નોંધ: નિગમ દ્વારા રજીસ્ટ્રેશન (નોંધલી) માટે ની અરજીની પ્રક્રિયામાં કોઈપણ કેરકારની જાલ નિગમની સત્તાવાર વેબસાઈટ ઉપર કરવામાં આવશે, જેથી કરી સમયાંતર પર www.gmdchd.com ની મુલાકાત લેતા રહેવું.



જોઈએ છે

મેડીક્લ ઓફિસર (R.M.O.) કચ્છની ગ્રામીણ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગ માટે એમ.બી.બી.એસ. - બી.એચ.એમ.એર મકક્ષ બે વર્ષના અનુભવી રેસિડન્ટ ડોક્ટર જોઈએ છે. અપેક્ષિત પગાર સાથે Email કરો :

vijaykeniya@gmail.com તથા આપનો સંપર્ક નં. ખાસ લખવો

જોઇએ છે

સિવિલ એન્જીનિયર

- પ વર્ષના બિલ્ડીંગ કામના અનુભવી
- બી.ઇ./ડિપ્લોમા સિવિલ એન્જીનિયર બિલીંગ એન્જીનિયર (અનુભવી)
- સાઇટ સુપરવાઇઝર (અનુભવી)

સ્થળ : કરછના સિવિલ કામ માટે M.99203 42025 | 91737 29921

दीनदयाल पत्तन पाधिकरण DEENDAYAL PORT AUTHORITY

AN ISO 9001:2008 & ISO 14001 : 2004 CERTIFIED PORT (ADVT. No. GA/PS/2023/Energy Manager/__) (Second Atten संविदा के आधार पर ०१ उर्जा प्रवंधक की नियुक्ति Engagement of 01 Energy Manager on contractual basis

दीनदयाल पत्तन प्राधिकरण, भारत सरकार के पत्तन, पोत परिवहत और जलमार्ग मंत्रालय के प्रशासनिक नियंत्रण के अधीन एक अग्रणी महापत्तन, संविदा के आधार पर उर्जा प्रवंधक (एक पद) के लिए पात्र एवं सक्षम व्यक्तियों से आवेदन आमंत्रित करता हैं।

The Deendayal Port Authority, Kandla a leadin Major Port under the administrative control Ministry of Ports, Shipping & Waterways, Govt. India, invites applications for engagement position of Energy Manager (01 No.) on Contractual basis, from the eligible and competent persons.

अधिक जानकारी और ऑनलाइन आवेदन पत्र भरने के लिए कृपय दीनदयाल पत्तन प्राधिकरण की वेबसाइट www.deendavalport.gov.in

For further details and online submission of application form, please visit Recruitment Section of Deendayal Port Authority's website at www.deendayalport.gov.in

आवेदन पत्रों की प्राप्ति की अंतिम तारीख : 25/09/2023 The last dae of receipt of applications is 25/09/2023

सचिव / Secretary निदयाल पत्तन प्राधिकरण ndayal Port Authority



વર મિલકતનું વર્ણન (શ્રી ધુવા નારાણભાઈ ની માલિકીની)

: પ્લોટને ડા, **પશ્ચિમ** : રોડ. ામ ભાગ અને જમીનું ક્ષેત્રકળ પ્લોટ ને.૩, (૮૪.૧૮ સ્કે.મી.) બીલ્ડીંગના બાંધ દો., રેવન્યુ સર્વે નં.૧૧૦ પૈકી VIII, મોતીનાગલપુર, અંજાર તાલુકો અને કર્ન રીતે વર્જાન વેચાલ કસ્તાલેજ નં.૨૬૪૧/૨૦૦૦ તા.૦૮.૧૦,૨૦૦૧ અને દે.૨, **પૂર્વે** : પ્લોટ નં. ૨૮, દક્ષિલો : પ્લોટ નં.૪, પશ્ચિમે : આંતરિક રોડ.

ગાંધીપામની ખાનગી પેથોલીજીકલ લેબોરેટરીઓ તરફથી એક્સાયેલન એકિક ઇન્ટરેસ્ટ સ્વાઈલ અને ક્રેક્સાયેલન એકિક ઇન્ટરેસ્ટ સ્વાઈલ અને કર્યા હોંકા અને સ્વાઈલ અને કર્યા હોંકા અને સ્વાઈલ અને કર્યા હોંકા અને કર્યા હોંકા સ્વાઈલ અને કર્યા હોંકા સ્વોઈલ ખાનગી પોલોલોજીકલ લેબોરેટરીઓ તરફથી દાંગા અમિત કરે હતામાં લેબોરેટરીઓ પેયું હોંકા હોંકા હોંકા કર્યા હોંકા ગજરાત સરકાર

વા વિભાગ વા વિભાગ યળ વન સંરક્ષકથી, કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ, અરિહંતનગર રોડ, ભુજ-ક્ચ્છ. ફોન/ફેક્સ નં. ૦૨૮૩૨ ૨૩૧૫૦૦ ટેન્ડર નોર્ટિસ નં. ૧૨-૧૩/૨૦૨૩-૨૪ (બીજા પ્રયત્ને)

છ પશ્ચિમ વન વિભાગ, ભુજ હસ્તે નીચેની વિગતે ક્વાર્ટર બાંધકામ કામ માટેન મગીરી અંગેના ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. ટેન્ડર ફોર્મ (નોન બલ) તેમજ ટેન્ડરનું વિગતવાર વર્શન વેબસાઈ પ્રામાં આવેલ છે. સદરહુ ટેન્ડર ઓનલાઈન ભરી દ

ક્રમ	વિગત	રેન્જનું નામ	ક્લળ	NIT/Tender detail
٩	કન્સ્ટ્રક્શન ઓફ કેટેગરી 'એ' કન્સ્ટ્રક્શન ઓફ કેટેગરી 'એ'	માંડવી	ગઢશીશા	610642
5	કન્સ્ટ્રક્શન ઓફ કેટેગરી 'બી' ટાઈટ ફોરેસ્ટ ક્વાંટર	દયાપર (દક્ષિણ)	બરંદા	610655

(સાંજના ૧૮.૦૦ કલાક સુધી) ન્ડર ફોક્યુમેન્ટ સ્વીકારવાની છેલ્લી તા. ૧૨/૦૯/૨૦૨૩

. સાંજના ૧૮.૦૦ કલાક ની તા. ૧૩/૦૯/૨૦૨૩, બપોરના ૧૨.૦૦ ક

નાવળ વન શરફાન કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ. -529-438-2023/28)

જાહેર ખબર

ધામ જિલ્લા ખાતે પોલીસ દળ માટે ગાંધીધામ, આદિપુર ત્રર તથા ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં સવ્યવસ્થિત ટાર્કિક નિયો૧ માટે લોકોના સહયોગ તેમજ તેમની અસરકારક ભાગીદારી વડે ટ્રાફિ બિગ્રેડ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અત્રેના જિલ્લામાં નીરે rણાવેલ વિગતે કુલ-૨૧ ટ્રાફિક બ્રિગેડ (મહિલા તેમજ પુરુષ)ની ભરત

અ.નં.	નગરપાલિકા વિસ્તારનું નામ	ભરતી કરવાની ટ્રાફિક બ્રિગેડની સંખ્યા		
०१	ગાંધીધામ	9.5		
0-5	આદિપુર	03		
03	અંશર	ou		
०४	ભચાઉ	०१		
		કુલ-૨૧		

- : શસ્તો :-જે માટે નીચે મુજબની લાચકાત ધરાવતા ઉમેદવ ઉમેદવારોએ તેમની અરજી નિચત અરજી ફોર્મ સાથે મોક્લી (૧) ઉમેદવારની ઉમર ૧૮થી ૪૦ વર્ષની હોવી જોઈએ.

. (૨) ઉમેદવાર ધોરણ-૧૦ પાસ હોવો જોઈએ. (૩) પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ ૫ કૂટ ૫ ઈંચ તથા મહિલા ઉમેદવાર માટે ૫ કૂટ હોવં

(નામાનિ-કચ્છ-૫૩૬-૨૦૨૩/૨૪)

નની હોવા જોઈએ.

વતની હિવા ગોઇએ. (પ) આ પોલીસ ભરતી નથી પરંતુ માનદ સેવહ તરીકે હામ કરવા ઇથ્યુક ઉમેદવારો અમંત્રણ આપવામાં આવે છે. પસંદગી પામેલ ઉમેદવારોએ ૮ (આઠ) હલાક ફરું બનાવવાની રહેલે અને પોલીસની મદદમાં રહેલાનું રહેલે જે બદલ મહેનાશા પે સરકારશ્રીના બિશમ મુજબ દૈનિક ભચ્યું માનદ વેતન તરીકે ચૂહવવામાં આવશે. (ફ) આ અંગેના નિચત વચેલ અરફ્યું ફોર્મ બર્દેસના પ્રસ્તિક થયાની તારીખાવી ત્યા ૧ ૧/૦૯/3 ર સુધીમાં અનેની પોલીસ અધિકાક ક્યેરી પૂર્ણ કથ્ય ગાંધીધામ ખાતેદ

(૭) આ અંગેના ભરેલ કોર્મ સ્વીક યા સુધી રહેશે. તમામ ભરેલા ફોર્મ રૂબરૂ કે ટપાલ મારફતે અત્રેની કચેરીની પર હાર (સીબી) શાખામાં ઓફિસ સમય ક્લાક : ૧૦.૩૦થી ૧૮.૧૦ દરમ્યાન

Welspun[®]INDIA વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ

પહોર પાત્રિક આર્કિકિટલે લેવન- LTTIIG(198PIC-03327) કર્મ, તમેરી ને પોત્રવન વિદેશ, આર્કિકિટલે લેવન- LTTIIG(198PIC-03327) કર્મમાં તમે તમેર પ્રાથમિક કર્માં કરમાં કર્માં કરમાં કર્માં કરમાં કર્માં કર્મા કર્મા કર્માં કર્મા કર્મા કરમાં કરમાં કર્મા કર્મા કર્મા કર્મા કરમાં કરમાં કરમાં કર્મા કર્મા કર્મા કર્મા કર્મા કરમાં કરમાં કર્મા કર્મા કર્મા કર્મા કર્મા કરમાં કરમાં કર્મા કર્મા કર્મા કર્મા કરમાં કરમાં કરમાં કરમાં કરમાં કર્મા કર્મા કરમાં કરમાં કરમાં કર્મા કર્મા કરમાં કરમાં કર્મા કરમાં કરમાં કરમાં કર્મા કરમાં કરમાં

નોટિસ

છ . (બી) રિમોટ ઇ-વોર્ટિંગ મંગળવાર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સવારે ૯.૦૦) શરૂ થશે અને ગુરુવાર ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સાંજે ૫.૦૦) કલાકે બંધ થશે . (સી) ૭૨-ઓફ તારીખના રોજ સભ્યોની મતદાન લાયકાત નક્કી કરવા માટે શુક્રવાર ૧૫

(સી) 86-ગ્યાફ લાસ્પ્રયાના માના માના માના સ્થારના સ્થા

ત્યારાભા મતાના ન્યાં વકતે એ.ડી. (એ છોકુલોમ દરમિયાન માનાની વૃત્તિયા અને લીસી(ઓએવીએમ મારફત એસ્ટ્રાઇમ હરાય એ તો હોવ્યા હરાશસ્ત્ર સિમોર ઇ-વોર્ટિંગ ન કરી શકે તેઓ ઇ-વોર્ટિંગ પ્રક્રિયામી મતાના કરી શક્ત કરો. (એ) સમ્યોનો મતાના અધિકાર કર ઓફ તાધીમ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩નાં પેટલા છોર સ્થાનના હોય તેટલા પ્રમાણમાં જ હઠકાર સ્ટેશે. (છ) એસ્ટ્રાઇમ નાહિલ મોકલા પાર્ચે હમાની તોર ધારાનાર સમ્યો મતાના કરવા પોઢે પુત્રમ

(3) એછુંએમ નેમિંક મોહવા પાકી બંગીનાં છે સ્થાનના સ્થામે માતાન હવા માટે યુષ્ટ મ આ લીધી અને પ્રાથમ લેવા સ્વાં કહ્યું કરે. આ માટે બેનાએસડીએલ અથવા સીડીએલએએ એમ્પ્રેન્સને નિર્મા કરવામાં મેળવી પકલો, જ્યારે એનાએસડીએલ અથવા સીડીએલએલ (એમ) સ્થાનો નું ઉપરક્ષ કે બેનાઓકિલ હોય હોય ઓપ્યાનાના પાસ્પર્વ કાંગ્યુલનાનાના કરી પછતો. (એમ) સ્થાનો નું ઉપરક્ષ કે બેનિફિલિલા ઓન્સ નિર્દેષ કે પ્રિક્રિયાના નિર્માન નિર્મા કરી પછતી કર્યા માટે ન્યાનો સ્થાનના નિર્મા કરી પછતી કર્યા માટે ન્યાનો સ્થાન નિર્મા કર્યા કર્યા કર્યા કરી કર્યા કરા કર્યા કર્યા

ઉપલબ્ધ છે. ઇપનીનાં સભ્યોએ શ્રી રાશિકાંત ચોરાટ, ઠંપની સેકેટરીને ૪થો માળ, વેલસ્પન હાઉસ, ઇપનીનાં સભ્યોએએ શ્રી રાશિકાંત વાપર માર્ગ, લોઅર પરેલ, મુંબઇ- ૪૦૦૧૧૩ સમાવ companysecretary_wil@welspun.com કે +૯૧ (૦૨૨) દૃદ્દ૧૩૬૦૦૭ ઉપર કોઈ પણ કામકાજનાં દિવસોએ સવારે ૧૧.૦૦થી સાંજે દૃ.૦૦ દરમિયાન સંપર્ક સાધ્યો.

ોનિક રાહે મતદાન પ્રક્રિયામાં કોઇપણ મુશ્કેલી જણાય તો એનએસડીએલ હેત્પ ડેસ્કને ng@nsdl.com ઉપર અથવા ઢોલ ફ્રી નં. ૦૨૨-૪૮૮૬૭૦૦૦ કે ૦૨૨-૨૪૯૯૭૦૦૦

ઉપર સંપર્ક લામાંથો. છેલ્લા સાત આનુપીંગેક વર્ષો દરમિયાન ડિવિડન્ડ નહીં માગનાર શેરપારકો માટે નોટિર હંબની પારો, ૨૦૧૩ની કલમ ૧૨૪(૬)ની મોગવાઈ તથા ઈન્વેસ્ટર રોખસુર્વેદન એન્ડ પ્રોટેક્શન હંડ ઓલોટીર (એકલિન્ડિંગ, બોડિટેંગ, ટુન્મફ્ટ એન્ડ ફિક્ક) નિયમો, ૨૦૧૬ વંચાણે વર્ષન ૨૦ સ્પેટેબર, ૨૦૧૬ માં અમલી અને બખતીવખત સુપારનો આત્રો લો ને પનીનો છેલા તો પારો ભાનુપીંગેલ વર્ષો દરમિયાન ડિવિડન્ડની જેમાં ગાંગી નહોય તેમનાં શેર' 'ઈન્વેસ્ટર રોખસુર્વેદન ભાનુપીંગલ વર્ષો દરમિયાન ડિવિડન્ડની જેમાં ગાંગી ન હોય તેમનાં શેર' 'ઈન્વેસ્ટર રોખસુર્વેદન શાનુધીનિક વધી દરમિયાના ક્રિકિક્કનના રછમ માત્રા ન લાવ લગ્નના ત્યાર વખ્યત્વન છે. એન્ડ્ર પ્રોટેક્સન ફર્જો ('Mulfullah') ખાતામાં કંપની પારો, ૨૦૧૩ની હલમ ૧૨ સરકારી ધોરણે જ્યા લેવામાં આવશે. મજફૂર સેરધારકોનાં નામ ફોલિયા નંબર ઠે ડીપી હલાયન્ટ આઇડી કંપનીની વેબસાઇ www.welspunindia.com ઉપર ઉપલબ્ધ યા વાયકુલાયોલ(ફિડિકન્ટ દાયો અંગેની હોપણ માહિતી[યારદીક્ટલ માટે હંપની સેકે.

CMYK —



SZEI GEZI

ભુજ એપીએમસીના ડાયરેકટર ભુરાભાઈ વરચંદનું નિધન

ભુજ : કચ્છના સહકારી ક્ષેત્રના આગેવાન અને કિસાનો - પશુપાલકોની મદદ માટે સદૈવ તત્પર રહેતા જનસેવક ભુરાભાઈ આલાભાઈ વરચંદના નિધનથી ઘેરાશોકની લાગણી ફેલાઈ છે.

એપીએમસીના ડાયરેકટર તરીકે સેવારત ભુજ તાલુકાના ડગાળા ગામના ભુરાભાઈ વરચંદનું ૫૮ વર્ષની વયે ગઈકાલે નિધન થયું હતું. ગઈકાલે આવેલા હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. ગઈકાલે તેમને મગજના પેરાલિસીસનો એટેક આવતા સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ આવતા તબીબોએ સારવાર માટે રાજકોટ રિફ્ટ કર્યા હતા. તેમને રાજકોટ લઈ જતી વખતે મોરબી નજીક હૃદયરોગનો હુમલો આવતા માર્ગમાં જ આંખો મીચી લીધી

સદ્ગત ભુરાભાઈ આહિર સમાજના શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. હાલે તેઓ સતાવરની ગોવર્ધન કન્યા વિદ્યાલય અને ધાણેટીની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે યોગદાન આપી રહ્યા હતા. તેઓ વર્ષ ૧૯૮૯માં સૌથી નાની વયના

ભુજ તાલુકાની કુંદનપર

પંચાયતી પ્રાથમિક

શાળાએ માહિતી

અને પ્રત્યાયનમાં

આપી નવી દિશા

તે વિષયના થોડા પાઠ ભણાવ્યા

બાદ મોટાભાગે સાપ્તાહીક

પરીક્ષા લેતા હોય છે. સામાન્ય

રીતે શિક્ષકો ઘરેથી મેન્યુઅલી

પેપર કાઢ્યા બાદ દરેક વિદ્યાર્થીને

નોટબુકમાં કે પેપર આપીને

પરીક્ષા લે છે. મેન્યુઅલી

ચેક કરીને બીજા દિવસે કે

પછી અનુકૂળતા મુજબરીઝલ્ટ આપ

ીને બાળકોને અભ્યાસ કરાવેલા

પાઠમાં કેટલું આવડ્યું તેનું મૂલ્યાંકન કરતા હોય છે. આ

પંધાતિ સામાન્ય રીતે સમગ્ર

શાળાઓમાં શિક્ષકો અનુસરે

છે. પરંતુ સરહદી કચ્છમાં ભુજ

તાલુકાનાં કુંદનપર પ્રાથમિક

શાળાના શિક્ષકો અને બાળકો

પારંપરિક પધ્ધતિ છોડીને

આજના ટેકનોલોજીના યુગમાં

આધુનિક અવધારણા અપનાવીને

ગણતરીની સેકન્ડમાં પરીક્ષા

આપવાથી લઇને શિક્ષકો દ્વારા

કરેલું પોતાનું મૂલ્યાંકન જાણી શકે

છે. કુંદનપર પંચાયતી પ્રાથમિક

શાળાના મદદનીશ શિક્ષક

નિલેષભાઇ રાજગોરે અથાગ

મહેનત કરીને ધો. ૬ થી ૮ સુધીના

અભ્યાસક્રમના તમામ વિષયની

૨૫૦૦થી વધારે પ્રશ્નોની ડિજિટલ

બેંક બનાવી છે. આ પ્રશ્નબેંકને

તેણે પ્લીકર્સ સોફ્ટવેરની

એપ્લીકેશન પર અપલોડ કરી છે.

આ સોફ્રટવેરના માધ્યમથી તેઓ

ટી.વી પર આવતા કોન બનેગા

કરોડપતિ ગેમની જેમ

કલાસરૂમમાં એલસીડી ટીવીમાં

ધીમી

મૂલ્યાંકનની

ભુજ : કલાસરૂમમાં શિક્ષક જે

સેવાભાવી અગ્રણીના નિધનથી કચ્છના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ફેલાયો શોક : રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ સદ્ગતને આપી શ્રદ્ધાજંલિ

ડગાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બન્યા હતા. આ ઉપરાંત તેઓ ભુજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને પ્રાથળિયા આહિર સમાજના પૂર્વ ઉપપ્રમુખ હતા. ખેતી અને ચાઈનાક્લેના વ્યવસાય સાથે સંકળાયેલા સદ્ગત ગરીબ દર્દીઓ અને શિક્ષેણ ક્ષેત્રે જરૂરતમંદોની મદદ માટે સદૈવ તત્પર રહેતા હતા. તેમના આંગળેથી કદીય કોઈ નિરાશ થઈ પાછું ફર્યું નથી. તેમના નિધનથી આહિર સમાજ અને સહકારી ક્ષેત્રને મોટી ખોટ પડી છે. તેઓ પુત્ર દિલીપભાઈ વરચંદ, પુત્રીઓ હિમીબેન શંકરભાઈ ઢીલા, ગીતાબેન ભગુભાઈ ઢીલા સહિત પરિવારને વિલાપ કરતો છોડી ગયા હતા.

તા.પં. પ્રમુખ વરચંદ, ભગુભાઈ ડાયાભાઇ ઢીલા, ઢીલા, દાનાભાઈ રાધાભાઈ ઢીલા, ગોપાલભાઈ

વરચંદ, માવજીભાઈ ઢીલા, વિરમભાઈ મેરિયા, ભગુભાઈ વરચંદ, શામજીભાઈ વરચંદ, હીરાભાઈ ઢીલા. દાનાભાઈ વરચંદ, કરમણભાઈ પટેલ, બુધાભાઈ ઢીલા, મ્યાજરભાઈ વરચંદ, રણછોડભાઈ ઢીલા, બળવંતભાઈ ઢીલા, જશાભાઈ ઢીલા, વેલાભાઈ વરચંદ, રાશાભાઈ વરચંદ, કરસનભાઈ પટેલ, રામજીભાઈ ઢીલા, ભગુભાઈ ધનાણી, ગોપાલભાઈ નોધાણી, સામાભાઈ ઢીલા, નારાણભાઈ વરચંદ, ડાયાભાઈ વરચંદ, મહેન્દ્રભાઈ ઢીલા, એચઆરડી ગ્રૂપના રાશાભાઈ ડાંગર, જીવોભાઈ માતા, લક્ષ્મણભાઈ ડાંગર, ભુરાભાઈ ડાંગર, ભીમજીભાઈ ડાંગર વગેરે ઉપરાંત રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ

સદ્ગતને શ્રદ્ધાસુમન અર્પણ

માધાપર હાઈવે પર બ્લોકના કારખાનામાં સ્વૈચ્છાએ શેડ તોડાયો, પણ મલબો ન હટ્યો

પર હોટલ ભવાનીની બાજુમાં સરકારી પડતર જમીનમાં બ્લોકનું કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકોની ફરિયાદ બાદ મામલતદારે દબાણ હટાવવા માટે સુચના આપતા પતરાનો શેડ તોડી દેવામાં આવ્યો છે, પરંતુ મલબો હટાવવામાં ન આવતા જાહેર રસ્તો ખુલ્લો મુકાયો નથી. જયાં સુધી મલબો નહીં હટે ત્યાં સુધી આ જગ્યા દબાણકાર છોડશે નહીં જેથી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર અબ્દુલ સતાર માંજોઠી દ્વારા અહીંના રહીશો સાથે આક્ષેપ કરાયો છે કે, માધાપર હાઈવે પર આવેલી હોટલ ભવાનીની બાજુમાં બ્લોકનું કારખાનું શરૂ કરાયું છે. સર્વે નં. પદ્દ પૈકીની સરકારી પડતર જમીન પર કરવામાં આવેલ

દબાણ સ્વેચ્છાએ તોડવા માટે ૨૨

ઓગસ્ટના શહેર મામલતદાર

દ્વારા નોટિસ આપવામાં આવી

હતી. જે બાદ અમુક ભાગ

તોડાયો છે, પરંતુ તેનો મલબો

પારિવારીક પ્રસંગની કોઈપણ

ઉજવણીમાં ખુબ દેખાડો, ભપકા

અને ખર્ચાઓ વધી રહ્યા છે

ત્યારે કચ્છના જાણીતા ગોપ્રેમી

એવા નાની નાગલપર અંજારના

મેઘજીભાઇ હિરાણીએ પોતાની

પુત્રી દિપીકાના જન્મદિવસ

નિમિતે ગૌકથાનું આયોજન કરી પ્રસંગને અર્થસભર બનાવ્યો

હતો. સ્વયં પોતે ગાયોનું પાલન

કરે છે એવા જાણીતા કથાકાર

શાસ્ત્રી ધનેશ્વર જોષીએ સરળ

ભાષામાં પ્રમાણભુત દાખલાઓ

આપીને સૌને દેશી ગાયનો

મહિમા અને ઉપયોગીતા

આપતા સ્વામિનારાયણ મંદિર

ભુજના ગાય આધારિત ખેતી

અભિયાનના મુખ્ય માર્ગદર્શક

એવા શાસ્ત્રી દેવચરણદાસજીએ

પરિવારમાં ગાયના પૌષ્ટિક

દૂધના વપરાશ ઉપરાંત ગોબર,

ગૌમુત્રથી ખેતીમાં કેવા

પરિવર્તનો આવી શકે છે તેના

સ્વઅનુભવ વર્શવીને આ વિષયે

લોકોને આગળ વધવા પ્રેરણા

આ પ્રસંગે આશિર્વચન

સમજાવી હતી.

ભુજ : માધાપર હાઈવે

આસપાસના રહેવાસીઓએ કરેલી માંગણી બાદ મામલતદારે દબાણ હટાવવા આપી હતી નોટિસ ઃ જ્યાં સુધી મલબો નહીં હટે ત્યાં સુધી રસ્તો ખુલ્લો થશે નહી

સ્થળ પર છે અને લાઈટ, પાણીના કનેકશન દૂર કરાયા નથી. જેથી ફરી દબાણ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ ત્યાં સુધી છે કે, દબાણકાર માથાભારે છે તેના ભાઈ સામે ચોરીની ફરિયાદ નોંધાયેલી છે. મકાન પણ દબાણમાં બનાવાયું છે જે દબાણ દૂર કરી સોસાયટીમાં આવવા જવાનો જાહેર રસ્તો ખુલ્લો કરવામાં આવે, અહીં આવતા પરપ્રાંતિય મજૂરો છેડતી કરતા હોવાને અને નશાની હાલતમાં હોવાના આક્ષેપ છે જેથી મલબો ખસેડી કબજો ખાલી કરી સોસાયટી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગાયના વિષય સાથે સંકળાયેલ

કાર્યકર્તાઓ આ પ્રસંગને માણીને

વ્યાપ સાથે કામ કરતી જાણીતી

સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના

મનોજભાઈ સોલંકીએ પણ

આયોજનથી પ્રભાવિત થઈ

પોતાનો આગામી જન્મદિવસ

ભારતીય તિશિ અનુસાર અને

ગૌકથા સાથે ઉજવવા ઉપરાંત

ગૌકથા કરતા કચ્છના દરેક

આયોજન ની સાર્થકતા સાબિત

કરી હતી અને સૌએ આ પ્રસંગ

માટે નિમિત બનનાર દિકરી

દિપીકાને હદયથી શુભેચ્છાઓ

સાથે આશિર્વાદ આપ્યા હતા.

પ્રારંભે ગૌપૂજન દેશી વૃક્ષોનું

વૃક્ષારોપણ બાદ મહાપ્રસાદનું

આયોજન કરા્યું હતું. આ પ્રસંગે

સહના અગ્રણી કાર્યકર્તાઓ અને

ગોપાલકો ઉપસ્થિત રહ્યા હોવાની

ગોસેવા ગતિવિધિના કચ્છ

વિભાગ સંયોજક પરબતભાઇ

સન્માનવાની

જાહેરાત કરીને

કલાકારોને

મહત્વની

દેશી ગાયના વિષયે મોટા

અભિભૂત થયા હતા.

માહી મિલ્ક પ્રોડયૂસર કંપનીની બારમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સભાસદો માટે ૮ ટકા ડિવિડન્ડ જાહેર કરાયુંઃ રૂપિયા ૨૦.૪૨ કરોડનો નફો નોંધાયો

રાજકોટ : દૂધ ઉત્પાદકોની

પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડની બારમી વાર્ષિક સાધારણ સભા સયાજી હોટલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાઇ હતી. વિશાળ દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન વિજયભાઈ ઓડેદરાએ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કંપનીએ સાધેલા વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. જ્યારે કંપનીના મુખ્ય કાર્યપાલક ડો. સંજય ગોવાણીએ વર્ષ



કાર્યની વિગત આપી હતી. કંપનીએ ગત વર્ષ દરમિયાન કુલ રૂપિયા ૧૪૪૪

કરોડની આવક નોંધાવી છે જ્યારે રૂપિયા ૨૦.૪૨ કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીએ તેના સભાસદોને ૮ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે કંપનીની દૂધ ઉત્પાદક સભ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. બારમી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરીને સભ્યોએ શિસ્તબધ્ધતાનું

અનેરૂં ઉદાહરણ પૂરું પાડ્યુ હતું. સાધારણ સભા પૂર્ણ થયા બાદ ૨૦૨૨૨-૨૩ના વર્ષ દરમિયાન કંપનીના તમામ નિયમોનું પાલન કરી વધુને વધ દૂધ ભરાવનાર વર્ગ અ, બ અને કના સર્વશ્રેષ્ઠ ત્રણ ત્રણ સભ્યો મળીને કુલ નવ સભ્યોને માહી રત્ન તથા પુરક આહાર પેટે પશુઓ માટે માહીદાણનો વધુ વપરાશ કરનાર ત્રણ સભ્યોને માહીદાણ ચેમ્પિયનના એવોર્ડ આપી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

અંજારની પ્રા. શાળા નં.૪ ખાતે વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયો

અંજાર : નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર ૪ ખાતે સીઆરસી અંજાર-૪નું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું, જેમાં સીઆરસી સંલગ્ન શાળાઓમાંથી ૨૨ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ ઉપર આયોજિત આ પ્રદર્શન જુદા જુદા પાંચ વિભાગમાં યોજાયું હતું. પાંચે પાંચ વિભાગમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ૧૧ કૃતિઓ રજૂ થઈ હતી.

આ પ્રદર્શનમાં કાસુન્દ્ર અંકિતાબેન, આયર નીતાબેન, છાભૈયા દિવ્યાબેન, બલદાણીયા સવિતાબેન, ટાંક ભરતભાઈ, સોરઠીયા વૈશાલીબેન સોરઠીયા, વંદનાબેન, રાઠોડ દર્શનાબેન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિભાગ ૧માં અંજાર નગરપાલિકા શાળા નંબર-૧ની

સ્પર્ધાત્મક

પરીક્ષાની તૈયારી

કરતા છાત્રોને ઈજન

દ્વારા વિવિધ સરકારી ભરતી

માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક

પરીક્ષાઓની તૈયારી કરતા

વિદ્યાર્થીઓ માટે જ્ઞાન આરાધના

દ્વારા દૈનિક નિઃશુલ્ક ઓનલાઈન

મોક ટેસ્ટ લેવામાં આવે છે.

તલાટી, જુનિયર કલાર્ક, ટેટ.

ટાટ, બિન સચિવાલય, પોલીસ

ભરતી વગેરે જેવી કસોટીઓની

તૈયારી કરતા વિદ્યાર્થીઓ

દૈનિક ઓનલાઈન મોક ટેસ્ટમાં

ભાગલઈ પોતાની તૈયારીઓનું

સ્વમુલ્યાંકન કરી શકશે. ભાષા,

વ્યાકરણ, ઈતિહાસ, સાંપ્રત

પ્રવાહો, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન,

ગણિત, રીજનીંગ વગેરે જેવા

વિષયો આધારીત ક્ષેત્ર નિષ્ણાંત

તજજ્ઞો દ્વારા કસોટી પત્ર તૈયાર

કરવામાં આવે છે. વિદ્યાર્થી

પોતાના મોબાઈલ ફોન,

કોમ્પ્યુટર કે લેપટોપ પર પોતાના

ફાજલ સમયમાં પરીક્ષા આપી.

પોતાનો સ્કોર જાણી સ્વમૃલ્યાંકન

કરી શકશે. સરકારી નોકરી

માટે પરીક્ષાની તૈયારી કરતા

તમામ વર્ગના છાત્રો નિઃશુલ્ક

મોક ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

આ ઉપરાંત પોતાના સામાન્ય

જ્ઞાનમાં વૃદ્ધિ કરવા ઈચ્છુક

કોઈપણ વયજૂથના વ્યક્તિઓ

પણ જોડાઈ શકશે. નામ નોંધણી

માટે મો. ૭૦૧૬૨ પર૭૯૯ પર

ભુજ : ગુજરાત સરકાર

કૃતિ વિજેતા થઈ હતી. વિભાગ હતી. નિર્ણાયક નિકુંજભાઈ તેમજ ર, ૩ અને વિભાગ ૫માં અંજાર

નગરપાલિકા શાળા નંબર-૪ની કૃતિ વિજેતા થઈ હતી. વિભાગ ૪માં અંજાર નગરપાલિકા શાળા નંબર દની કૃતિ વિજેતા થઈ હતી. પ્રદર્શનમાં વિજેતા થયેલી કૃતિ અને તેના બાળ વૈજ્ઞાનિકો અંજાર તાલુકાના બ્લોક કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે. વિજેતા થયેલા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી સીઆરસી કો.ઓ. બીનાબેન મકકડ દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રદર્શન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલું હતું. પ્રદર્શનમાં ભાગ લીધેલા તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષકો દ્વારા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રદર્શનની નજીકની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આચાર્ય વિમલભાઈ ઠક્કર અને નંદલાલ માતાએ વ્યવસ્થા સંભાળી હતી.

વેલસ્પન ઈન્ડિયા લિમિટેડ Welspun INDIA

(કોર્પોરેટ આઇકેન્ટીટી નંબર - L17110GJ1985PLCO33271) ૨જી.કચેરી : "વેલસ્પન સિટી", ગામ વર્ષામેડી, તા. અંજાર, જિ. કચ્છ, ગુજરાત-૩૭૦૧૧૦ देवि. +६१ २८३५-५५११११ हेह्स +६१ २८३५-२७६०१०

કોર્પો. કચેરી : વેલસ્પન હાઉસ, કક્ષો માળ, કમલા મિલ્સ કંપાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ, મહારાષ્ટ્ર-૪૦૦૦૧૩ ટેલિ : +૯૧ ૨૨-૬૬૧૩૬૦૦૦ ફેક્સ : +૯૧ ૨૨-૨૪૯૦૮૦૨૦ ઇ-સેઇલ companysecretary_wll@welspun.com વેબ : www.welspunindia.com

<u>नो हिस</u>

આથી આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૩૮મી વાર્ષિક સાધારણ સભા (''એજીએમ'') શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩નાં સવારે ૧૧,૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ ('વીસી') અન્ય ઓડિયો વિઝયુઅલ મીન્સ ('ઓએવીએમ') બ્રારા એજીએમ નોટિસમાં દર્શાવેલ કાર્ચવાદી માટે ઈ-વોરિંગ સુવિધાથી વાજવામાં આવશે. એજીએમ વીસી/ઓએવીએમ ભારત કંપની દારો, ૨૦૧૩ અને કોર્પોરેટ અદેર્સ મંત્રાલયનાં તથા સેબીનાં પરિપત્રની જેગવાઇ અનુસાર ચોજારો, જેમાં પ્રોક્સી <mark>નીમવાની</mark> સુવિદ્યા ઉપલબ્ધ રહેશે નહીં, એજીએમમાં જેડાવા અંગેની સદાળી માહિતી નોટિસમાં દર્શાવી છે.

होर्पोरेट अहेर्स मंत्रालयनां सामान्य परिपत्र नं. १०/२०२२ ता. २८ डिसेम्बर એચઓ/સીએન્ડી/પીઓડી-૨/પી/સીઆઈઆર/ ૨૦૨૩/૨૪ તા. પ જાન્યુઆરી, જનવળા સાંબલા કર્યા પાંચાડાન્ય પો/સાંબાઇલાઇ/ ૨૦૧૩/૧૩ તો. ધ ગાવ્યુંઆઇ, ૨૦૧૩ને સેબી (ફર્વ "ધી સરક્યુલર") વંચાઇ લઇએ એઝએમ નોટિસ તથા ૧૦૨૨ ૨૩નો વાર્ષિક અદેવાલ કંપનીના સભ્યોને કંપની/ઉપોઝિટરી પાર્ટિસિપન્ટસ ખાતે ઉપલબ્ધ નોંઘાયેલ ઈ-મેઈલ સરનામે મોકલી આપેલ છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.welspunindia.com તથા બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com ઉपरात नेशनल सिङ्योरिटी डिपोऊिटरीऊ लिभिटेड www.evoting.nsdl.com ઉપર ઉપલબ્ધ છે. કંપનીએ પાત્રતા ધરાવતા તમામ સભ્યોને એજીએમ નોટિસ અને ૨૦૨૨-૨૩નો વાર્ષિક અદેવાલ મોકલવાની કામગીરી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પૂર્ણ કરી છે, જે સભ્યોનાં સરનામાં કિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતે નોંધાચેલ ન होય, પરંતુ પ્રત્યક્ષ શેરધારક होય तेઓ કંપની રજિસ્ટ્રાર અને શેર द्रान्सइर अंकन्ट सिन्ड धनटाधम धन्डिया प्राधपेट सिमिटेडने rnt helpdesk@linkintime co. In สินร อเนริง รวเป ขเรย

કંપનીની કટ-ઓફ તારીખ શુકવાર, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩નાં રોજ પ્રત્યક્ષ કે ડિમટીરીયલાઈઝ સ્વરૂપે શેર ધરાવતા હોય અને એજીએમ નોટિસમાં દર્શવિલ કાર્યવાહીમાં ભાગ લેવા માટે એનએસડીએલ ('રિમોટ ઈ-વોર્ટિંગ') દ્વ<mark>ારા એજીએમમાં ભાગ લઈ</mark> શકશે. કંપનીએ રિમોટ ઇ- વોટિંગ પ્રેકિયા માટે કુ. માનસી <mark>શાદ, મે, જેએમજેએ</mark> એન્ડ એસોસિયેટ્સ, કંપની સેકેટરી (પ્રેકિટસ નં. ૮૧૨૦), મુંબઇની સ્કૂટીનાઇઝ્ટ તરીકે નીમણુક કરેલ છે.

રિમોટ ઈ-વોર્ટિંગ પ્રક્રિયાની માહિતી નીચે મુજબ છે :

(એ) કંપનીએ એજીએમ નોટીસમાં દર્શાવેલ કાર્યવાહી અંગે રિમોટ ઇ-વોરિંગ અને ઈ- વોર્ટિંગની સઘળી પદ્ધતિ વિશે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩નાં મોલાવેલ નોટિસમાં

રિમોટ ઈ-વોર્ટિંગ મંગળવાર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સવારે ૯.૦૦) શરૂ થશે

અને ગુરુવાર ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સાંજે ૫.૦૦) કલાકે બંધ થશે.

કટ-ઓફ તારીખના રોજ સભ્યોની મતદાન લાયકાત નક્કી કરવા માટે શુક્રવાર ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ગણાશે.

રિમોટ ઈ-વોટિંગ ગુરુવાર ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના સાંજે ૫.૦૦ કલાકે બંધ થશે તેથી ત્યારબાદ મતદાન થઈ શકશે નહીં.

એજીએમ દરમિયાન મતદાનની સુવિધા અને વીસી/ઓએવીએમ મારફત એજીએમ રાવ અંગે કોઇપણ કારણસર રિમોટ ઇ-વોર્ટિંગ ન કરી શકે . તેઓ ઈ-

વોર્ટિંગ પ્રક્રિયાથી મતદાન કરી શકશે. સભ્યોનો મતદાન અધિકાર કટ-ઓફ તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩નાં જેટલા

શેર ધરાવતા <mark>હોય તેટલા પ્રમાણમાં જ હક્કદાર રહેશે.</mark> એજીએમ નોટિસ મોકલ્યા પછી કંપનીનાં શેર ધરાવનાર સભ્યો મતદાન કરવા માટે ચુઝર આઈડી અને પાસવર્ડ evoting@nsdl.com.in કે કંપની રિજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટને વિનંતી કરવાથી મેળવી શકશે, જ્યારે

એનએસડીએલ એથવા સીડીએલએલ ખાતે અગાઉથી નોંઘાયેલ હોય તેઓ પ્રવર્તમાન પાસવર્ડ મારફત મતદાન કરી શકશે. (એચ) સભ્યોનું રિજસ્ટર કે બેનિફિશિયલ ઓનર તરીકે કિપોઝિટરી ખાતે કટ-ઓફ તારીખે નોંધાયેલા સભ્યો એજીએમ દરમિયાન મતદાન કરી શકશે.

(આઈ) એજીએમ શરૂ થયાં પહેલાં જે સભ્યોએ વીસી/ઓએવીએમ દ્વારા રિમોટ ઈ-વોટિંગ કર્યું હશે તેઓ એજીએમ દરમિયાન હાજર રહી શકશે, પરંતુ ફરીથી भतहान हरी शहशे नहीं. એજીએમ નોટિસ અને રિમોટ ઈ-વોર્ટિંગ પ્રક્રિયા કંપનીની વેબસાઈટ

www.welspunindia.com એન એસડીએલ evoting@nsdl.com ઉપર ઉપલબ્ધ છે. કંપનીનાં સભ્યોએ શ્રી શશિકાંત થોરાટ, કંપની સેક્રેટરીને ૪થો માળ, વેલસ્પન

હાઉસ કમલા મિલ્સ કંપાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-४०००१३ अथपा companysecretary_wil@welspun.com +૯૧ (૦૨૨) ૬૬૧૩૬૦૦૦ ઉપર કોઈ પણ કામકાજના દિવસોએ સવારે ૧૧.૦૦થી સાંજે ૬.૦૦ દરમિયાન સંપર્ક સાધવો.

ઈલેકટ્રોનિક રાદે મતદાન પ્રક્રિયામાં કોઈપણ મુશ્કેલી જણાય તો એનએસડીએલ દેલ્પ કેસ્કને evoting@nsdl.com ઉપર અથવા ટોલ ફ્રી નં. ૦૨૨-૪૮૮૬૭૦૦૦ है०२२-२४८६७००० ઉपर संपर्ध साधयो.

છેલ્લા સાત આનુષંગિક વર્ષો દરમિયાન ડિવિડન્ડ નહીં માગનાર શેરધારકો માટે નોટિસ કંપની ધારો, ૨૦૧૩ની ક્લમ ૧૨૪(૬)ની જોગવાઈ તથા ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન કંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટિંગ, ટ્રાન્સફર એન્ડ રિફંડ) નિયમો, ૨૦૧૬ વંચાણે લઈને હ સપ્ટેમ્બર, ૨૦૧૬માં અમલી અને વખતોવખત સુધારાને ધ્યાને લઈને કંપનીનાં છેલ્લા સાત આનુષંભિક વર્ષો દરમિયાન ફિવિકન્ડની રક્મ માગી ન હોય તેમનાં શેર 'ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફર્ડ' (આઈઈપીએફ) ખાતામાં કંપની ધારો, ૨૦૧૩ની કલમ ૧૨૫ દેઠળ સરકારી ધોરણે જમા લેવામાં આવશે. મજફર શેરધારકોનાં નામ ફોલિયા નંબર કે ડીપી આઈડી-કલાયન્ટ આઈડી કંપનીની વેબસાઈટ

www.welspunindia.com ઉપર ઉપલબ્ધ થશે. વણ ચૂકવાચેલ/કિવિકન્ટ દાવો અંગેની કોઇપણ માહિતી સ્પષ્ટીકરણ માટે કંપની સેકેટરી અને રિજસ્ટ્રાર તથા ટ્રાન્સફર એજન્ટને કંપનીની રિજસ્ટર્ડ કોર્પોરેટ કચેરીએ સંપર્ક સાધી શકાશે.

મંબઇ, ઓગસ્ટ ૩૧, ૨૦૨૩

વેલસ્પન ઈન્ડિયા લિમિટેડ વતી સદી/-શશિકાંત થોરાટ કંપની સેક્રેટરી

કચ્છના ગાય પ્રેમી પરિવારે કરી સરહદી કચ્છની સરકારી શાળાના શિક્ષકે પરંપરાગત લેખિત કસોટીને જન્મદિવસની અનોખી ઉજવણી ત્યજી બાળકોનું મૂલ્યાંકન કરવા અપનાવી રસપ્રદ ડિજિટલ પદ્ધતિ



કઇ રીતે કામ કરે છે આ પદ્ધતિ ?

આ અંગે વધુ વિગત આપતા શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શેક્ષક નિલેષભાઇ રાજગોર જણાવે છે કે, અમારા દ્વારા શાળામાં પરંપરાગત લેખીત કસોટીના સ્થાને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મૂલ્યાંકન સોફ્ટવેર ઓનલાઇન નિઃશૂલ્ક મળી રહે છે. તેથી કોઇપણ શાળા કે શિક્ષક ધારે તો તેનો ઉપયોગ કરી શકે છે. માત્ર તેણે પોતાના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો અને જવાબ તૈયાર કરીને સોફ્ટવેરમાં ફીટ કરવાના હોય છે. જે બાદ કલાસમાં ૫૦ બાળકો કે તેનાથી વધુ કોઇ ફેર પડતો નથી. તમામ કયુઆર કાર્ડ પર મોબાઇલ દૂરથી જે ફેરવતા ગણતરીની સેકન્ડમાં કર્યા બાળકે સાચો કે ખોટો જવાબ આપ્યો તે જાણી શકાય છે. બારકોડ સ્કેન થતાં જ બાળકના નામ જોગ લેપટોપ,ટીવી કે મોબાઇલની સ્ક્રીન પર પરીશામ આવી જાય છે. જો પ૦ પ્રશ્નોની પરીક્ષા આ રીતે ગોઠવી હોય તો અંતે કયા બાળકે કેટલા પ્રશ્નના જવાબ આપ્યા ત્યાંથી લઇને કોણે સૌથી સાચા કે ખોટા જવાબ આપ્યા વગેરે અલગ અલગ રીતે મૂલ્યાંકન કરી શકાય છે. એક ચાર્ટ તૈયાર થઇ જતો હોય છે. જેના પરેથી શિક્ષક તમામ સ્તરે વિદ્યાર્થીઓની શક્તિને પારખી શકે છે. આ સાથે બાળકના વ્યક્તિગત પરર્ફોમન્સની પીડીએફ વાલીઓને મોકલીને તેઓને પણ નિયમિત રીતે બાળકની પ્રગતિથી માહિતગાર કરી શકાય છે.

તેની સામે બાળકો પાસે કે.બી. સીના સ્પધર્કની જેમ જવાબ આપ વા ટચ સ્ક્રીન માધ્યમ ન હોવાથી તેના વિકલ્પમાં સસ્તો અને વધુ બેહતર ઉપાયરૂપે વિદ્યાર્થીઓને ક્ચુઆર કોડ પ્રિન્ટ કરેલું પેપ માત્ર બાળકોએ પકડેલા કાર્ડ રકાર્ડ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને તેના રોલનંબર સાથેનું ક્યુઆર કોડ કાર્ડ આપવામાં આવે છે. જેની પર ચાર ખૂશે રોલનંબર પ્રિન્ટ કરેલો છે તે સાથે દરેક સાઇડ પર ક્રમ મુજબ મધ્યમાં

છે. પ્રશ્ન ફ્લેશ થતાં જ બાળકો શિક્ષક તેના સ્થાને ઉભા ઉભા પર મોબાઇલ ફેરવે કે તરત જ કલાસરૂમમાં બેઠેલા તમામ બાળકોના જવાબ એપ્લીકેશનમાં

ડુમરાના ખેડૂત ખાતેદારના

૩૫ વર્ષ જૂના વિવાદ

કેસમાં નાયબ કલેકટર

અબડાસાનો ચુકાદો

ખેડૂત ખાતેદારના હક્કો સ્વીકારાયા

હતા અને વેચાણ નોંધ મંજૂર કરવા

હુકમ કરવામાં આવેલ હતો. ખેત

મજૂર ખાતેદાર તરફે એડવોકેટ પ્રફુલ

ક્યુઆર કાર્ડ શિક્ષકને ઉપર કરીને દર્શાવે છે. ઝિપગ્રેડ એપ્લીકેશન ઓપન કરીને મોબાઇલ મારફતે રેકોર્ડ થઇ જાય છે. તેઓ ઉમેરે છે કે, આ સિવાય પ્લીકર, ક્વિઝી વગેરે જેવા મૂલ્યાંકન સોફ્ટવેર

ત્રાયાની સીમમાં પોતાના ઘરે યુવકે ગળેફાંસો ખાઈ લીધો ભુજ : તાલુકાના ત્રાયા

શખ્સે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃ ત જાહેર કર્યો હતો. ત્રાયા ગામે રહેતા સોમાભાઈ દલપતભાઈ વસાવા (ઉ.વ.૪૫) વાડીએ હતા દરમિયાન રાત્રીના એક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે ભુજ ની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા માધાપર પોલીસે આગળની તજવીજ હાથ

આપી હતી. ઠેર-ઠેરથી આવેલ જણાવાયું હતું. કચ્છ યુવક સંઘ નવી

રાષ્ટ્રીય સ્વયંસેવક

ગોરસીયાની

ગામે વાડી વિસ્તારમાં રહેતા ઉજવી છે.

મુંબઈ શાખા દ્વારા

મુંબઈ શાખા દ્વારા નવી મુંબઈ મહાનગરપાલિકાના મેડિકલ સ્ટાફ અને સફાઈ કામદાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. લગભગ ૬૦ જણાઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. નવી મુંબઈ શાખાની ૧૦ બહેનો કાર્યકર્તાએમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નવી મુંબઈ શાખા સતત ૭ વર્ષથી અલગ અલગ ક્ષેત્ર જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, પોસ્ટ ઓફીસ સ્ટાફ સાથે ભૂતકાળમાં રક્ષાબંધન

રક્ષાબંધનની ઉજવણી મુંબઈ : કચ્છ યુવક સંઘ નવી

> PUBLIC TRUSTS REGISTRATION OFFICE GREATER MUMBAI REGION, MUMBAI

Address: Dharmaday Ayukta Bhavan, 1" Floor, Sasmira Building, Sasmira Road, Worli, Mumbai, Maharashtra—400 030. **PUBLIC NOTICE OF INQUIRY**

સંપર્ક કરવો.

Regd. Address: 101, 1" Floor, Takshshila Co-Op. Hsg. Soc. Ltd, Gokuldas, Madhavda: Pasta Road, Behind Chitra Cinema, Opp. Petrol Pump, Dadar (East), Mumbai-400014. B.P.T. Registration No: F-12534 / Mumbai. Applicant-HEMANT RAVJI KARANI All concerned having interest-

Purchase Consideration: urchase Value Stamp Duty

This 31" Day of AUG; 2023

પરથી પણ ડાઉનવોડ કરી શકશો અને તમારા મહોરબંધ EOI પર સ્પષ્ટ રીતે "પેથોવોજીકવ તપાસ માટે <mark>EOI – એનક્ષર I અને એનેક્ષર II" વખીને 18</mark>709/2023 સુધીમાં નીચે સહી કરનારને મોકવી આપશો. ડિવિઝનવ મેડિકલ ઓફિસર, સબ ડિવિઝનવ રેવવે હોસ્પિટલ ગાંધીધામ - 370201

અમને લાઇક કરોઃ 🚹 facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 💥 twitter.com/WesternRly

ધી ગાંધીધામ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ. જીએમસીબી ભવન, પ્લોટ નં. ૧૨, સેક્ટર-૦૯, ગાંઘીઘામ-કચ્છ.

અમારી બેન્કના નીચે જાણાવેલ સભાસદશ્રીઓ ના તેમના નામ સામે જણાવેલ સંખ્યા મુજબના બેન્કના શેર ગુમ થયેલ છે. જો આ શેરો પર કોઈ નો હકક કે હિસ્સો હોય તો બેન્ક ને દિવસ ૭ (સાત) <mark>માં જાણ કરવી. અન્યથા બેન્ક તેઓને ડુપ્લીકેટ શે</mark>ર કાઢી આપશે. જેની સીએ નોંધ લેવા વિનંતી.

શેર ઘારકનું નામ શેર ની સંખ્યા 1) HUSAIN CHAVDA સુનિલકુમાર એન. ગોચલ (જનરલ મેનેજર/સી.ઈ.ઓ.)

પશ્ચિમ રેલવે - અમદાવાદ ડિવિઝન <u>ગાંધીયામની ખાનગી પેથોલોજીકલ લેબોરેટરીઓ તરફથી</u>

સબ ડિવિઝનવ <mark>રેલવે હોસ્પિટલ ગાંધીધામ, પશ્ચિમ રેલવે, રેલવે લાભાર્યીઓને પે</mark>થોલોજીકલ સુવિધાઓ આપવા માટે ગાંધીધામમાં સ્થિત ખાનગી પેથોલોજીકલ લેબોરેટરીઓ તરફથી EOI આમંત્રિત કરે છે તમામ લેબોરેટરીઓએ પૂર્વ-નિર્ધારિત લાયકાત માપદંડોને પરિપૂર્ણ કરવાના રહેશે અને રેલવે સાથે પેથોલોજીકલ તપાસના આઉટસોર્સિંગ માટે માન્યતા / મેમ્પેનલમેન્ટ માટેના નિયમ<mark>ો અને શરતો સ્વીકારવાના રહેશે. જો રસ પરાવતા</mark> હો તો તમે અમ્યુગલમું માંગા ભાવમાં અને શાંતા વસાય અને શરતો / એનેક્ષર ! અને !! ની વિગતો નીચે જણાવેલ સરનામેથી માપદંડ / નિયમો અને શરતો / એનેક્ષર ! અને !! ની વિગતો એકત્રિત કરી શકો છો અથવા તો રેલવેની વેબસાઇટ <u>www.wr.indianrailways.gov.in</u>

તારીખઃ- ૧૭/૦૮/૨૦૨૩ નં. MD/SBI/173/LAB

એસ. ઠક્કર હાજર રહ્યા હતા. ધરી હતી. the matter of "KUTCHYUVAK SANGH-Change Report No.: ACC/VII/1680/2023 अहर नोटीस in the name of the Trust?

તારીખ:29/08/2023

એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ

WHEREAS in the above application for registration under Section 22 of the Maharashtra Public Trusts Act, 1950 an inquiry is to be made of the said act, on the Following points by Assistant Charity Commissioner - VII Greater Mumbai Region Weather Below mentioned property is the property of the trust and could be register IMMOVABLE PROPERTY: Plot No. 37 Area 83.63 Sq. Mtrs. i.e. 100.02 Sq. Yds. Plot No. 38 Area 149.73 Sq. Mtrs. i.e. 179.07 Sq. Yds, Total Area 233.36 Sq. Mtrs. i.e. 279.09 Sq. Yds, Situated at. Ramdev Nagar, Revenue Survey No. 423 (Part-1) at Gadhsisa Tal. Mandvi, Dist-Kutch. Bounded as under: owards the East:- Plot 39, 40, 41. owards the West:- 7.50 mtrs. Road owards the North:- Shishu Vatika owards the South:- Plot No. 36. Rs. 1,00,000/-Rs. 4,900/-Rs. 1,400/-Regd. Fees Rs. 1,06,300/-This is to call upon you to submit your objections, if any, in the matter before the Ld Assistant Charity Commissioner-VII Greater Mumbai Region, Mumbai at the above address within 30 days from the date of publication of this notice failing which the change report will be decided and disposed of on its own merits.

Given under my hand and seal of the Hon'ble Joint Charity Commissioner, Greate Mumbai, Region, Mumbai.

Superintendent (J) **Public Trusts Registration Office** Greater Mumbai Region, Mumbai

ચાર વિકલ્પ સાથે પ્રશ્નો દર્શાવે છે. એ, બી, સી, ડી પ્રિન્ટ કરેલું પણ વાપરી શકાય છે. भेत भिर्रेन पण भेडूत हुडे હેમલાઈ ફળિયામાં પાણી

ભુજ : ડુમરા ગામની ખેતીની જમીનના વેચાણ માતમ ચોકની બાજુમાં આવેલ હેમલાઈ ફળિયામાં પાણી ઢોળવા દસ્તાવેજ સામે વાંધો ઉપસ્થિત મુદ્દે બોલાચાલી થઈ હતી. સકીલ કરી તે જ ગામમાં જાડેજા જીતુભા હુંશેનભાઈ શેખે નોંધાવેલી ટપુભા સહિતના ત્રણ વિવાદીઓએ ફરિયાદ મુજબ આરોપીઓ આ જ ગામના ખેડૂત ખાતેદાર રાજગોર ગીરીશકુમાર મોહનલાલ હાફ્રિઝ નવસાદ શેખ, હમીદ હુશેન શેખ અને મુનીર હુશેન પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીનો ધારણ કરે છે. તેવો વિવાદ શેખે ફરિયાદી સાથે કેમ વધુ પાણી લાવતાં નાયબ કલેકટર, અબડાસાએ ઢોળો છો તેમ કહીને બોલાચાલી કરી હતી. બોલાચાલી કરવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી ધકબુસટનો માર માર્યો હતો. તેમજ ફરિયાદીની એક્ટિવા ખાડામાં નાખી નુકસાન કરતા અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઢોળવા મુદ્દે બોલાચાલી અંજાર : શહેરમાં વોર્ડ નં.૮

બંને પક્ષોની રજુઆત સાંભળી, ઉઠાવાયેલ વાંધો રદ ફરમાવી, વેચાણ દસ્તાવેજ માન્ય રાખ્યો હતો. આ ખાતેદાર ગીરીશકુમાર રાજગોર સામે ૧૯૮૯થી ખેડૂત ખાતેદાર ન હોવાનો વિવાદ ચાલુ હતો, પરંતુ તેમના તરફથી ખેત મજૂર હોવાનાં આધારો-ઠરાવો રજૂ કરાતાં તેમના ા જયશ્રી દરિયાલાલ દેવ !! ા જયશ્રી જલારામ બાપા ! ्र लोहाए॥ सनः १ लोहाए॥ सुवड मंडल सामा શ્રી આદિપુર લોહાણા સમાજના સાનિધ્યે

૩૧મો સરસ્વતી સન્માન સમારંભ-નિમંત્રણ સમારંભ તા.૦૩/૦૯/૨૦૨૩, રવિવાર સાંજે ૫.૦૦ કલાકે કે.જી.થી કોલેજ સુધીના <mark>વિદ્યાર્થીઓ તથા ઉચ્ચશિક્ષણક્ષેત્રે</mark> સિધ્ધિ પ્રાપ્ત કરનાર આપર્ણ તેના <u>'તેજસ્વી તારલાઓ'</u> ને સન્માનિત કરવા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવ ચોજાચેલ સરસ્વતિ સન્માન સમારંભમાં સર્વે જ્ઞાતિજનોએ પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. સમારંભના પ્રમુખ : શ્રી રમેશભાઇ કે. માણેક (પ્રમુખશ્રી, આદિપુર લોઠાણા સમાજ) દિપ પ્રાગટ્ય : શ્રીમતિ ઉષાબેન ઠક્કર (માજી સાંસદ અને મહિલા અગ્રણી) તથા સંસ્થાકીય વિવિદ્ય સામાજીક અગ્રણીઓ અને સમારંભના દાતા પરિવારો ઉપસ્થિત રહેશે

સ્થળ : આંબેક્કર ભુવન, રોટરી સર્કલની બાજુમાં, ઢાગોર રોક, આદિપુર-કચ્છ. ૩૭૦૨૦૫ શ્રી આદિપુર લોહાણા સમાજ દ્વા શ્રી આદિપુર લોહાણા યુવક મંડળ રમેશબાઈ કે. માણેક-પુમખશ્રી સેટાંગ સી.સોમેશ્વર-પ્રમુખશ્રી ચિરાગ સી.સોમેશ્વર-પ્રમુખશ્રી સાગર બી. રામાણી-મંત્રીશ્રી ભરતભાઇ કે. રૂપારેલ-મંત્રીશ્રી બરતબાઇ કે. રૂપારેલ-મંત્રીશ્રી મનીષબાઇ કી. મજેઠીયા-ચેરમેન શિક્ષણ સમિતિ કું જ્ય હાલાણી -ચેરમેન શિક્ષણ સમિતિ